

શ્રી તપગચ્છના અધિકાર્યક દેવ-

# શ્રી માણિભક્ત ચરિત્ર

લખી તેમાર કરનાર

પ્રસિદ્ધ વડતા

સુનિ મહારાજશ્રી ચારિત્રવિજયજી મહારાજ.



શ્રી માંગરોળ તપગચ્છના ધની આર્થિક મદદારી  
છપાવી પ્રસિદ્ધ કરનારા:-

સમયધર્મ કાર્યાલય

સોનગઢ (કાઠીસાવાડ).

સં. ૧૬૬૮ ]-

પ્રથમ આવૃત્તિ

- [ સને ૧૬૪૨

મિન્ડ ફોલો. ૦૮-૦૮



---

શુદ્ધઃ—શ્રી અમરસ્વામી અહેતુકાયા  
શ્રી બાળદુરસિંહજ પ્રાન્દીન પ્રેરણ—પાણીતાણ.

## આ હિનીવેદન



તપશ્ચાચમાં માણિકદના નામથી ટોડેંડ જ અપરિચિત હો.  
કેમકે માણિકદ એ તપશ્ચાચના અધિકાર્યક હોય છે. જુદા જુદ  
મચ્છોના પ્રભાગવત્તાર જુદા જુદા હોવો અધિકાર્યક તરીકે નિર્ભિત  
થાય છે. તપશ્ચાચના અધિકાર્યક માણિકદ, ખરતશ્ચાચના અધિકાર્યક  
માણિકદ, અંગલશ્ચાચના અધિકાર્યક મહાકાળી એમ દરેક મચ્છોના  
અધિકાર્યક હોવો છે.

જ્યો જ્યો તપગચ્છના ઉપાશ્રય જૂતા વખતના છે ત્યા ત્યા દરેક ડેકાણે ધથ્યા ભાગે ઉપાશ્રયમાં માણિલદ્રની સ્થાપના હોય છે. આ રીતિ જળવી રાખવા માટે આપણા તપગચ્છના પતિઓનો ઉપકાર માનવામાં આવે છે. પતિઓએ વાંબાડળ સુધી જહેજલાલી ભોગવી રાજ મહારાજાઓને વશ કર્યા, ગામ આસ મેળવ્યા, અને સંઘને પણ કુશગતામાં રાખી સંઘને અન્યુદ્ય કર્યો. એ બધો પ્રતાપ તપગચ્છના મહાનું અધિષ્ઠાયકહેવ માણિલદ્રનો છે. આને પણ માણિલદ્રની માન્યતાઓ ચાલે છે અને તે માન્યતાઓ ઇણીભૂત પણ ચાય છે. જ્યાંસુધી પતિઓનો ઉપાશ્રયોમાં વાસ હતો ત્યાંસુધી માણિલદ્રની પૂજા, સેવા અંકિત સારા પ્રમાણમાં થતી હતી. હજુ અંકિતવત્સલ શ્રાવકો પણ એમની સેવા પૂજા કરી રહ્યા છે. પરંતુ દીલગીરી સાથે લખણું પડે છે કે આધુનિક સાધુ સમુદ્ધયે માણિલદ્રનું મહાત્મ ભૂલાયું છે. તેમની અંકિતમાં ક્રીદુર્બારાયુંન્યું છે. તેમના પરિચયથી શ્રાવકોમાં પણ એવા સંસ્કારો પેહા થયા છે. તેથી હાલમાં બધાતા નવા નવા ઉપાશ્રયોમાં માણિલદ્રની સ્થાપના બિલકુલ કરવામાં આવતી નથી. એનું પરિણામ એ આવરો કે જાળિ તપગચ્છાનુયાભિયો માણિલદ્રનું નસ્તાનિઃસ્તાન પણ જૂલીજૂલી રહ્યો. જ્યાં જ્યાં નોંધે કિએથી માણિલદ્રની સ્થાપના હોય તે ઉપાશ્રય તપગચ્છાનો છે એ સર્જું પૂરવેનું પણ હું તો નાથ થવા વ્યક્ત છે.

૧૧. સ્થાપિલદ્રની સ્થાપનામંત્રનો મોદ્દાનું પ્રમાણે માણિલદ્રની વાણું ચંખનાં  
થયા. તીવ્ર ધૂદૂષ કાઢી અને સુધૂં લાખાસેડાં કરીએનું પ્રમાણે  
મળી આવે તો તેમના જીવન ઉપર ફાંઝક પ્રકાશ પૂર્વવારમાં આવે નો

આજાતા સેવતાં બેડા વખત પહેલાં ઉત્તર ગુજરાતના પાટાણ શહેરનું અંગરેજીએ એક પુરાણી પ્રત અમોને ઉપલબ્ધ થઈ. તેના ઉપરથી આપોજે આ જીવનચરિત્ર લખયું છે. ને આની સાથે જુદી જુદી એ ચાર પ્રતો મળી અર્થ હોત તો લખવામાં અમોને વધારે જીવનચરિત્ર મળત. અમો માનીએ છીએ કે એક જ પુરતા ઉપરથી આ જીવનચરિત્ર લખાયું છે. રેમાં ધણી જુદીએ રહી જવા સંભવ છે. તેથી જુદુપ્રથમ અનુરા પ્રેમપાત્ર મુત્તિએને અને ધીના વિદ્ધાનોને કલામણું કરીએ છીએ કે હોઈ ડેક્ષાણીથી માણિલાના જીવનચરિત્રનું લખાયું મળે. તો એર કર્માને સેપુલ્ટરી આપજા તરતી બેશો કે જેથી ધીજ સ્થાપનિમાં સુધારો વધારો કરવામાં આવે અને ને પુરતા અમોને સેપુલ્ટરવાળાં આવશે. તેની નકલ કરી મૂળ પુરતા તરતજ પાછું એકબનાર ધૂસુને સેપુલ્ટરી ઢેવામાં આવશે.

માણિલદળની ઉત્પત્તિના સંબંધમાં ને એક જાતની દંતકથા ચાલી રહી છે તે આ જીવનચરિત્રના લખાણ ઉપરથી સાચી સાખીત થતી નથી.

દંતકથા એવી ચાલે છે કે ધીના મરજના આચાર્યે તમનેસુધારાના અધિશદ્ધાયક, દેવદારા ઉપસર્ગ શરૂ કર્યા. તેથી ધણું તપગણના આપણેનાં મરણ થવા માંબાં. આ ઉપરથી તપગણના આચાર્ય અણાં ચક્ર, પુણું કાર્યસેક્ષણમાં પડ્યા છે. તે વખતે એક વૃદ્ધ માણિલદ રોક આચાર્ય છે. આચાર્ય મહારાજને કાર્યસેક્ષણમાં એડેલા જોઈ પોતે કાર્ય પૂર્ણ કરે છે. આચાર્ય મહારાજ તેણું કાર્ય કરે છે. ત્યારે રોક કરે છે. કે સહૃદાયક! જાનો ઉપરથી ન થઈ શકે? એના જીંદગી માની શકે?

છે. એનો ઉપાય તમારા હાથમાં છે. શેડ કલે છે કે મારા દ્વારા હેઠળ તો કેરમાનો. ગુરુ મહારાજ માણિલાદ રોહને કહે છે કે શેડ તું તમારું આસુષ્ય હું વે ત્રણ દિવસનું છે એ એ આસુષ્ય પૂર્ખ થયે તમારું ભૂતું તો અવશ્ય છે જ પણ ને તમે સંસાર બ્યવહારનો ત્યારું કરી, અઠમનું તપ કરી મારી પાસે ઉપાયથમાં અનશન કરો. અને હું તમોને ખૂલ્યાન્ધીનમાં અંતરધ્યાન બનાવું તો શુદ્ધ ધ્યાન-પૂર્વક તમો મરીને દેવગતિમાં જાઓ. અમે તે પછી આ ઉપસંહર્તા તમે દેવ થઈને ટાળો. શેડ કહે છે કે ગુરુરાજ એક તો મારું કલ્યાણ થતું હોય અને મારા હાથે સંધનું ભલું થતું હોય તો હું તેમ કરવા તૈયાર છું. આ પછી માણિલાદ શેડ અનશન કર્યું છે અને તે નીચે દીવસે મરીને દેવ થયા છે. અવધિસાનથી જોઇ તરત જ ગુરુ પાસે હાજર થયા છે. ગુરુની આગામી પરમાણુના દેવને હાડી અનુભૂતિ હો. અને તપગચ્છને નિરપદવ બનાવેલ છે. તે પછી ગુરુ મહારાજે માણિલાદ દેવને તપગચ્છના અધિષ્ઠાયક દેવ તરીકે સ્થાપ્યા છે. આવી દંતક્ષયા ચાલે છે. પરંતુ આ લુવનચરિતમાં તો લોકાગચ્છના આચાર્ય દીળા-બેરવ અને કાળાબેરવની આરાધના કરી તપગચ્છના આચાર્ય શ્રી હેમ-વિમળસરીના શિષ્યોને મારી નાખવા અની બેરવેને આત્માઉરેલ તેથી આગ્રામાં ધણ્યા શિષ્યો મરી ગયા. તે પછી ગુરુ મહારાજે શાસનહેવીની આરાધના કરી છે. શાસનહેવીએ પ્રત્યક્ષ થઈ કર્યું છે કે તમો ગુજરાત તરફ જાઓ. ત્યા પાલનપુર નજીકમાં આ ઉપરથે શાંત કરનાર તમોને ભળી રહેશે. ગુરુએ તરત ગુજરાત તરફ વિહાર કર્યે છે. અહીં ઉન્નેથી નગરીના નગરશેઠ અનનજળનો ત્યાગ કરી પણપાળા ચાલી સિદ્ધજિરિની યાત્રાની પ્રતિસ્તા લઈ ચાલી નીકળેલ છે. તેને પાલનપુર

નજુકની જાડીમાં ચોરેઓ મારી નાખેલ છે તે મરીને માણિબદ હેવ  
થયેલ છે. ગુરુ તે સ્થળમાં આવ્યા છે. તે હેવ ત્યાં પ્રત્યક્ષ થયેલ છે  
અને ઉપરથ શાંત કરેલ છે. એ માણિબદ હેવના શરીરના નથુ કટેકા  
ચોરેઓ હરી નાખેલ. તેના મર્સ્તકનો ભાગ ઉજજ્વયણીની કિપ્રા નદી  
પાસે માણિબદનું સ્થાન થયું. તે ત્યાં પૂજાય છે. ધડ આગડોલ  
જામમાં પૂજાય છે. અને પગની પેંડીઓ પાલનપુર પાસે મગર-  
જામમાં પૂજાય છે. તે પછી સૌ તપભયછના અધિષ્ઠાયક થયા છે.  
અને જ્યાં તપભયછનો ઉપાશ્રય હોય ત્યાં તેની સ્થાપના હોવી જ  
નેહાયે એ પદ્ધતિ શરૂ થઈ. આવી હકીકત આ જીવનચરિત્રમાં  
આવે છે. દંતકથા કરતાં આ વાત પુર્સ્તક ઉપરથી લખાયલી હોવાથી  
અનુભરણૂત ભનાય એ સ્વાભાવિક છે. જ્યાં અમો વાચના રાણીને સંપ્રેષ  
વિનાસીએ જીવેને જ્યાના કરતાં વિશેષ અથવા હેરકાર કોધના ધ્યાનમાં  
હોય તો જરૂર અમને લખવું. જેથી અમો ખીલુ આવૃત્તિમાં સુધ્યારો  
વધારો હરી શકીએ અને હકીકત પૂરી પાડનારાઓનો ઉપકાર  
માની શકીએ.

લી. મુનિ ચારિત્રવિજ્ઞયાલ.



## ઉપકાર


આ ચદ્રિત તૈયાર કરી આપનાર પ્રસિદ્ધ વડતા મુનિમહારાજ શ્રી ચારિત્રવિજયજી મહારાજનો ઉપકાર માનીએ છીએ. તેમજ આ પુસ્તક છાપવા માટે આર્થિક મદ્દ કર્નાર શ્રી મંબેણ તપ્યાંનું જાંખનો ઉપકાર માનવામાં આવે છે. પણ આ ચદ્રિત તપાસ્કાનામાં સારી મદ્દ આપનાર કર્યાના કવિ શ્રી દુલેરાય એલ. કોરણીનો પણ ઉપકાર માનવામાં આવે છે.

દી. સમયધર્મ કાર્યાલય.

## અનુક્રમણીકા

નં.	વિષય	પૃષ્ઠ
૧	માલવક્ષમિ. ...	૧
૨	પરિવર્તન. ...	૮
૩	માતાનું હેત અથવા સતીનો સત્યાગ્રહ. ...	૧૪
૪	શુદ્ધાગમન. ...	૨૧
૫	ધરસ્ક્રૈટ. ...	૨૭
૬	ક્રોટી. ...	૩૭
૭	પ્રતિષ્ઠાધ. ...	૪૩
૮	આગ્રામાં આતુર્માસ. ...	૫૦
૯	મંત્ર સોધના. ...	૫૭
૧૦	આત્મ જવિદાન. ...	૬૦
૧૧	પૂજન વિધિ... ...	૬૨
૧૨	શ્રી માણિભદ્રાનો છંદ. ...	૬૪
૧૩	કળાદ. ...	૬૨
૧૪	ગરભો. ...	૬૩
૧૫	માણિભદ્ર પક્ષકી સ્તુતિ. ...	૬૭
૧૬	દેખા. ...	૧૦૪
૧૭	આરતી. ...	૧૧૩





## શ્રી માણિભદ્રજી વીર

ખી. પી. પ્રેસ—પાલીતાણા.

Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

[www.umaragyanbhandar.com](http://www.umaragyanbhandar.com)





# વીર માણિલદ



પ્રકરણ પહેલું

—  
માલવભૂમિ

માલવ ભૂમિની મહત્ત્વા ભારતવર્ષના ઈતિહાસમાં સુવિશ્વાસિત અંકિત છે. માલવભૂમિ એ ભારતની ભૂત-કાળીન લભ્યતાના ક્રીતિકળશ સમાન છે. વિધા અને કળાની ઉપાસનાથી પરમ પ્રખ્યાતિને પામેલા, તેમ જ એક વખત સમસ્ત ભારતવર્ષના આકર્ષણુદ્ય બનેલા, રાજ લોજ એજ માલવભૂમિના અમૃતમય અંકમાં ઉછ્યો હતા. લોજ

૧

રાજના અસીમ ઔદ્યોગ અને પ્રખર વિદ્યાગ્રેમને પરિષ્ઠામે જ માલવ ભૂમિ દેશવિદેશના શારહા—મંહિર સમાન બની હતી.

પંડિત પ્રવર કાલિદાસ જેવા વિનોદી અને વિદ્યાચતુર વિકાનો એ જ ભાગ્યશાળી ભૂમિના પોળામાં એલી ગયા છે.

અફખર-ધીરખલની માઝુક એકાકાર બની ગયેલા અને અનેક ચાતુર્યકથાઓના કેન્દ્ર અનેકા લોજ-કાલિદાસ સમા નરરતનોને પોતાના ડેતાળ હૈયામાં આશરો આપનાર માલવભૂમિની મહત્ત્વા ઓછી કેમ અંકાય !

હેવી સરસ્વતીના પરમ સેવક અને ઉપાસક હોવા ઉપરાંત પ્રણયપથની પરિસીમાંચે પહોંચી જનાર મહા પ્રતાપી રાજ સુંજ પણ એ જ અદ્રભૂમિના એક અમૃત્ય રણ હતા.

જેના પવિત્ર નામનો સંવત્સર ચલાવીને ભારતભૂમિએ જેનું પુનિત સમરથુ પોતાના હૃદયમાં સદાને માટે કાયમ માટે કોતરી રાખ્યું છે, એવા મહાપરાકમી અને પરહુઃખ-ભંજન રાજ વીર વિક્રમાદ્ધિત્ય પણ એ જ માલવહેશના એક અદ્વિતીય નરવીર હતા.

આવા આવા અનેક પુરુષપુંગવો પોતાનો ઉન્નત કીર્તિધવજ ને ભૂમિ પર ફરકાવી ગયા છે, એ રતનગર્ભા માલવભૂમિને હજરો ધન્યવાદ હો !

માલવ હેશમાં ઉજજ્યિની નગરી એ સુવર્ણમુદ્રામાં એક સુંદર રત્નસમાન શોલે છે. એ નગરીના અમર નામની સાથે અનેક નરવીરોની ઉજજ્યણ ધતિહાસગાથાએ ગુંથાયલી છે. એના નામની સાથે જ જેડાએલ ક્ષિપ્રા નદી, ગંધર્વી સમશાન, અને અનેક પ્રકારની મંત્રસાધનાઓની દિલ ધડકાવનારી હૃદયલેદ્ધક કથાએઓ આજ પણ આપણા અંતરના તારને જણુઅણુાવી રહે છે. કંઈ કંઈ કાપાલિકોના ધામસસું ઉજજ્યિની નગરીનું એ ગંધર્વી સમશાન ભારત-ભરમાં એક અનેડ છે.

આમ યુગયુગની યશધ્વળ ફૂરકાવતી ઉજજ્યિની નગરી આજ પણ અનેકાનેક ચિન્હવિચિત્ર સંસ્કરણોના સ્તૂપ સમી ઉજ્ઞત મસ્તકે જાલી છે.

આપણે જે સમયની વાત આદેખી રહ્યા છીએ, તે સમયે ઉજજ્યિની નગરી ચોરાશી ચૌટાં અને ભાવન અનારોથી ધમધમી રહી હતી. કેસર, કસ્તુરી, કરિયાણ આહિ વિધવિધ પ્રકારની વસ્તુઓથી અનરે લરપૂર ભરેલી જેવામાં આવતી હતી. આનુણાનુના અનેક ગામોના લોડો દરરોજ હુનરોની સંખ્યામાં ઉજજ્યિનીની અનારોભાંથી માલ ખરીદવાને આવતા. તેમજ મોટા મોટા નવદેખી વણુઅરા પોતાની લાખો ચોડો સહિત નાના પ્રકારની વ્યાપારની વસ્તુઓ સાથે ઉજજ્યિનીની વારંવાર મુલાકાત દેતા,

હુનર, ઉદ્ઘોગ, ચિત્રકામ, શિલ્પ, સ્થાપત્ય આદિ કલાઓના કલાધરોની કદરહાની તેમની ચોચ્યતાના પ્રમાણમાં ખરાખર થતી હોવાથી, એવી અનેકવિધ કળાઓ ત્યાં વિકાસની પરાકાશાં પહોંચી હતી.

શહેરની અંદરનાં મકાનો તેમજ ચૈટાંઓની રચના અને બાંધણી સપ્રમાણ હોવાથી તેમની રમણીયતામાં એચ વધારો થતો હતો. નગરની બહારના ભાગમાં જુદીજુદી જાતનાં કૂલોની કૂલવાડીઓ, તેમજ કૂલકૃતાદિના બાગ બજીઓઓ, ઉત્તમ માળીઓની દેખરેખ નીચે ઉછરતા હોવાથી, ઉજાજિનીતું કુદરતી સૌન્હય અનેકગણું બીલી બઠકું હતું. ચંપો, ચંપેલી, મોગરો, માલતી, બદી, બ્રહ્મ આદિ સુગંધી પુષ્પોના સુવાસને પવનની લહરિઓ કિશ્માનદીના સુંદર તટ પર પ્રસારી હેતી હોવાથી ઉજાજિની નગરીના શોભીન જવાનો સંદ્યા સમયે એ સ્થાન પર સહેલ માટે નીકળી પડતા. એ વખતે ત્યાંનો હેખાવ એક મોટા મેળા જેવો અની રહેતો. આવી ઉજાજિની નગરી એ અરસામાં લારતવર્ષના મસ્તકમણું સમાન હતી.

તમામ પ્રજા કર્તાવ્યપરાયણ તેમજ ધર્મનિષ્ઠ હોવાથી સુખ સંપત્તિની ત્યાં છોળો ઉછળતી. પરસપરના સુંદર સહીકારથી ઉજાજિની પ્રજા એકથીજા પ્રત્યેની પોતાની ઝરણે સુંદર રીતે અજાવી રહી હતી.

ધનાઠયવર્ગ ધર્મપ્રેર્ભી તેમ જ અન્ય વર્ગ પ્રત્યે સહ્ય-  
ભાવ ધરાવનાર હોવાથી એમનું આંતરિક જીવન સુખ  
અને શાન્તિથી વ્યાપ્ત હતું. શ્રમજીવી વર્ગ પણ શ્રીમ-  
તોના સંપૂર્ણ પ્રેમભાવથી સદા ઉત્સાહિત રહેતો. એ ઉત્સા-  
હમાંથી જ અનેકવિધ અવનવી કળાઓ જન્મ પામતી અને  
વિકસતી. શ્રીમતોની એક માત્ર અમીદિત્ત જ શ્રમજીવીઓના  
જીવનને સુખ અને સંતોષથી લર્દીદેવાને ખસ છે, એનું  
જીવંત દિશાંત આથી મળી રહેતું.

ભરત, ગૂંથણુ, કાંતણુ, વણ્ણાટ આદિ અનેક કારીગ-  
રીઓ ત્યાં ધર્મધૈકાર ચાલી રહેલી હોવાથી, દેશ પરહેશના  
અનેક બાણુકારો અને શ્રમજીવીઓ ઉજ્જવિનીમાં આવીને  
વસવાટ કરવા લાગ્યા હતા.

ધર્મપ્રાણુસમાં દેવહેરાસરો, મહામંહિરો તથા આશ્રમ-  
ઉપાશ્રીયોમાં આખ્યાનવ્યાખ્યાન તેમ જ પુજન સ્તરવન આદિ  
અનેક પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિઓ ચાલી રહેલી હોવાથી  
લક્ષ્મિમાન લાવિકવર્ગ સદા ધર્મધ્યાનમાં પ્રવૃત્ત રહેતો.

કેાઈપણુ શહેર, નગર, કે દેશને ઉજ્જતિના પથ પર  
અદાવનાર, ધર્મ એ જ એક પવિત્ર સાધન છે. ધર્મ એ  
માનવપ્રાણીની રજેરગમાં વહેતું એક અમેલું પ્રાણુતત્વ છે.  
આ ધર્મભાવના જ માનવપ્રાણીને પશુની કેટિથી જુદો પાડે છે.

ધર્મભાવના પ્રત્યે માણુસ એક ચા ખીલ રીતે પણ અવર્ય આકર્ષણીય છે. કારણ એ છે કે ધર્મ એ જીવના સ્વભાવની અંદર જડાએલી વસ્તુ છે. જેએ ધર્મના નામે ભડકે છે, તેએ પણ જાણે અનાણે કોઈને કોઈ વસ્તુને ધર્મ જેટલી જ મહત્ત્માથી સ્વીકારી રહ્યા હોય છે. માનવ-પ્રાણીનો સ્વભાવ જ એવો ઘડાયદો છે, કે તે કોઈપણ રીતે ધર્મ વિના ચલાવી શકતો નથી. પછી તે એક ચા અન્ય સ્વરૂપમાં.

ધર્મપ્રેમ અને કર્ત્તાંયપરાયણુતા એ ઉજઝયિનીની પ્રજાનો આહશાં હતો. અને એથી એ પ્રભાનો આત્મા જાણે અનાણે દિનપ્રતિદિન વિકાસને પંથે પ્રયાણુ કરી રહ્યો હતો.

ઉજઝયિની નગરી એ જૈનધર્મના પણ પરમ ધામ સમાન હતી. ઉજઝયિનિની શોલારૂપ અનેક જૈન શેડ શાહુકારોનો ત્યાં ધણ્ણા પુરાતનકાળથી વસવાટ હતો. એમાં ધર્માવતાર સમા માણેકશાહ શેષી ઉજઝયિની નગરીના નગરશેડ હતા. માણેકશાહ શેડ લક્ષ્મિના લંડાર અને ધર્મ પ્રત્યે અપાર મમતા ધરાવનાર હતા. ધર્મભાવનાનો પાઠ એમની માતા કસ્તુરખાએ એમને ગળથુથીમાં જ આપ્યો હતો. એમની માતા કસ્તુરખાની સુવાસ ખરેખર કસ્તુરીની માઝક ચારે તરફ ફેલાએલી હતી. એમના પતિનાં અવસાન પછી

એમણે પોતાનું સમસ્ત લુધન ધર્મધ્યાનમાં અને ત્યાગ-વૈરાગ્યમાં જ વીતાંશું હતું. આની પ્રથળ અસર અનાચાસે માણેકશાહ શોઠમાં ડાતરી આવી હતી. માણેકશાહ એમની માતાના એકના એક સંતાન હોવાથી તે અત્યંત લાડ-કોડમાં ઉછરેલા હતા. આમ છતાં પણ તે માતાની આજાનું કદ્દીપણું ઉદ્દલંઘન કરે એવા ન હતા માતાની આજા એમને મન હેવાજા હતી. માતાનાં સુખહુઃખ એજ એમનાં સુખહુઃખ. હતાં માતાના હૃદયને કદ્દી પણ એક તલ ભાત્ર હુલાવવાને એ તૈયાર ન હતા. આ માતાપુત્રનો પ્રેમ સમસ્ત ઊજયિનીના આદર્શરૂપ હતો.

માણેકશાહ શોઠ અઠળક વર્ણિતાપાણિત મિલકૃતના માલિક હતા. એટલું જ નહિ પરંતુ તે પોતે પણ બ્યાપારી કુનેહના પૂરેપૂરા જાણુકાર હોવાથી પોતાના ધંધામાં હિવસે હિવસે ઝાવતા જતા હતા. એમની બ્યાપારી કુનેહનો પાચો સત્ય પર ચણુાયલો હોવાથી એમના ધરની અંદર પણ સત્યુગનો જ વાસો હતો. \*

## પ્રકારણ આજું

### પરિવર્તન

ઉજજયિની નગરીના બરાબર મધ્યલાગમાં આવેલું જૈન  
દોંડાઅંછ ઉપાશ્રયનું એક વિસ્તીર્ણ ભક્તાન શહેરની શોલામાં  
સુંદર વધારો કરો રહ્યું હતું. આરોગ્યશાસ્કના નિયમ અનુસાર  
જૈન જનતાના દરેક ઉપાશ્રયમાં પવન અને ગ્રાંથાની વિપુલતા  
પ્રથમ દષ્ટિઓ જ દષ્ટિગોચર થાય છે એટલું જ નહિ પરંતુ એ  
સ્થાનની સ્વચ્છતા અને સુધરીતા પણ દરેક વ્યક્તિને અવશ્ય  
આકર્ષી રહેછે. એમાં પણ આ તો માલવભૂમિનાં નાક સમી  
ઉજજયિની નગરીનો ઉપાશ્રય એટલે એમાં પૂછવું જ શું !

આજે વહેલી પ્રભાતથી જ આ ઉપાશ્રયનાં મકાન પ્રત્યે ઉજાયિનીવાસીઓએ મીટ માંડી હતી. સમુદ્રની લરતી ચેઠે માનવમેહિનીનો ધસારો પળે પળે વધતો જતો હતો. જેતનેતામાં જ આ આખું મકાન જૈન અને કૈનેતર વર્ગથી લરચક ભરાઈ ગયું.

આ જૈન ઉપાશ્રય આજે ઉજાયિનીવાસીઓનું લક્ષ્ય-બિન્હુ બન્યું હતું. તેનું કારણું એ હતું, કે આજે લોકાગચ્છના આચાર્ય પદ્મનાભસૂરિનું ત્યાં જાહેર વ્યાખ્યાન હતું. આચાર્ય શ્રી હમણું થોડા દિવસ થયાં જ ઉજાયિનીમાં પદ્માર્થી હતા. આ અવસરમયમાં જ એમણે પોતાની વાક્યાથી ઉજાયિનીવાસીઓને મુગધ કરી દીધા હતા. આજે પણ એમના ધરોપદેશનું શ્રવણ કરવા માટે લોકસમૃદ્ધાય પ્રભાતથી જ કીડીઓની માડક ઉભરાઈ રહ્યો હતો.

દરેક જૈનઉપાશ્રય સવારે અને બપોરે અનાયાસે એક વ્યાખ્યાન મંહિરમાં ફેરવાઈ જાય છે. વ્યાખ્યાનના સમયની આ પસંદગીને કરા જીણી નજરે નિહાળતાં એમાં પણ ડાહાપણુંના ફરિયાબ જેવા જૈનોની સુંદર કરકસરનાં ફર્શની થાય છે. પ્રાતઃકાળનો જે વખત ધણું લોકો જાબારની મીઠી જાગ્રતી જાંધમાં ગાળી નાંખે છે, અને બપોરનો એ સમય ડેટલાક લોકો લામુકુલ્લિના આજામમાં વીતાવી હે છે, એ અ-

મૂલ્ય સમયનો ઉપયોગ ચતુર જૈન જનતા ધર્મધ્યાનમાં અને ધર્મોપહેશનાં શ્રવણુમાં કરેછે. આ રીતે એને સમયની સુંદર કરકસર નહિ તો બીજું શું કહેવું ?

દોકાગચ્છના આચાર્ય શ્રી પદ્મનાભ સૂરિનો મીડી કંડ આજે વહેલી સવારથી જ અહીં ગર્વવા લાગ્યો હતો.

વકૃતૃત્વ કળા એ તો જણે જૈન ધર્મશુરુઓના ધરની મૂડી જ ગણ્યાય. એ મૂડીનો વારસો સાધુસમાજમાં અતિ પ્રાચીનકાળથી ઉત્તરોત્તર ચાલ્યો આવેછે. આજે પણ કોઈ કોઈ મુનિ મહારાજેમાં વકૃતૃત્વની એ અનેરી કળા પરાકા-ઠાએ પહેંચેલી જોવામાં આવે છે. શ્રોતાવર્ગને એક ધરીએ ખડખડાટ હસાવીને બીજું જ ધરીએ રડતા કરી મૂડવાની અજ્ઞાન શક્તિ આજે પણ જૈન મુનિમહારાજેમાં મોઝૂદ છે. હાસ્ય, શ્રોક, ગંભીર્ય, ફઃખ, ફંદ આદિ વિધવિધ લાગળીઓને સુખમંડળ પર અતિ અદ્ભુત રીતે જીતારવાની અનોખી કળા આજે પણ કોઈ કોઈ જૈન મુનિઓમાં અસ્તિત્વ ધરાવતી દષ્ટ-ગોચર થાય છે. આવા સમર્થ મહાત્માઓની વાણી શ્રોતા વર્ગના જ્ઞાન્યપર અજ્ઞાન અસર કરે છે, અને ટંકોતીણુંવતું તેમાં ફોતરાઈ જાય છે. આવી અનેરી શક્તિ ધરાવનાર મુનિમહારાજેને આજે પણ સમાજ તરફથી “મહાન વકૃતા,”

“ સમર્થ વક્તા ” આહિ માનવંત વિશેષણોથી બિરહાવીને એમની એ શક્તિની ચોંચ કદર કરવામાં આવે છે.

ધર્માચારોની આ તાકાત ખરેખર અલૌકિક હોય છે. જે કાર્ય તોપોતલવારોનાં ભીષણું બળથી પાર પડી શકતું નથી, તે કાર્ય ધર્મગુરુઓની વાણીની શક્તિ વડે એક જ વચ્ચનમાં પાર પડી શકે છે. આવાં અનેક ઉદાહરણો આજે પણ ઈતિહાસપટ ઉપર સુવિષ્ણુક્ષરે અંકિત છે.

આચાર્યશ્રી પદ્મનાલસ્ફુરિપણું આવા એક પ્રથમ પંક્તિના વક્તા હતા. ઉજજયિની નગરીની જનતા આજે એમની વાણીનો લાલ લેવા માટે ઘેલીતૂર ધની હતી. સમસ્ત વ્યાખ્યાન મંહિરમાં તલપૂર જેટલી જગ્યા પણ બાકી રહેલી જણ્ણાતી ન હતી. એક તરફ પુરુષો અને બીજું ખાનુ ઊવગંધી આખું મહાન ચિકાર લરાઈ ગયું હતું. આગલી હરોળમાં રાજ્યના શાનદિપાસુ કર્મચારીઓ પણ દિશિગોચર થતા હતા.

આચાર્યશ્રીની ખરાખર સન્મુખે શહેરના નગરશોઠ માણ્યુકશાહ શ્રેષ્ઠીએ ચોતાનું સ્થાન લીધું હતું. સ્ફુરિલની વાક્યટાચે માણ્યુકશાહનાં મન પર અજખ ભૂરકી છાંટી હતી. શક્તિવંત વાણીગ્રવાહ મહાન મનુષ્યોને પણ ચોતાના વેગમાં ઘસ્સડી જાય છે ત્યાં માણ્યુકશાહ સમાન અતિ સુકોમળ અને ભ્રવનાવાદી માણ્યુસનું શું પુછવું !

આપણી આ નવલકથાના સમયમાં જૈનોમાં પક્ષલેદનું વાતાવરણ અતિ ઉચ્ચ અન્યું હતું. એક થાપે અને ધીજે ઉથાપે એવી સ્થિતિ ચોતરદ્દ ચાલી રહી હતી. તપગચ્છ અને લોકાગચ્છ વચ્ચેની ખેંચતાણું પ્રથમ સ્વરૂપમાં પ્રવર્તમાન હતી. આ કારણથી જ આજે લોકાગચ્છના આચાર્ય પદ્મનાભસૂરિ જિન-વચ્ચની આજા દોપીને પોતાના પક્ષને પ્રથમ અનાવવાનો અ-તિષેધ કરવામાં પોતાની તમામ શક્તિ વાપરી રહ્યા હતા.

માણેક શાહ શોઠ મહા ધર્મપ્રેમી હતા. એચો ઉજાયિ-નીના ધર્મવિશારદ સમૂહમાંના એક અથગણ્ય ગૃહસ્થ ગણ્યાતા. તેઓ શુદ્ધ શાવકધર્મ અને કુળાચારનું પાલન કરતા. શ્રી જિનધર્મને જ તેઓ સર્વસ્વ માનતા. કોઈપણ પ્રકારના સંનેહોમાં જિનધર્મના આદેશની તે અશાતના કરતા નહિ. હેવફેરાસરમાં પૂજા, આંગી તથા અકૃમ તપ આદિમાં કદી પણ કશી ઉણુપ આવવા હેતા નહિ. પદ્મનાભસૂરિની વાણી હમણું હમણું એમને એમના કુળાચારના ધર્મથી દૂરદૂર ધસડી જતી હતી અને એમાં એમનો હોષ ન હતો. શક્તિશાળી વાણીનો વેગ એતદો પ્રચંડ હોય છે, કે ધણી વાર ધણી વ્યક્તિઓ જણે અજણે અને પરાણે પણ એ વાણીના વેગમાં ધસડાઈ જાય છે. આ પ્રમાણે માણેકશાહ શોઠ પણ આચાર્યશ્રીની વાક્યાટ અને શક્તિનાં તેજમાં અંનાધને ઉલટે માર્ગે આકર્ષણ્ણવા લાગ્યા હતા. આ વસ્તુ

પદ્મનાભસૂરિની ચડોાર દષ્ટિથી બહાર ન રહી. માણ્યુકશાહ શેડ જેવા ઉજાયિની નગરીના એક અથગણ્ય ગૃહસ્થ પર પોતાની ધારેલી અસર થતી જતી જેઠને સૂરિણુના આનંદનો પાર રહ્યો નહિ. આથી તેમણે પોતાની તમામ શક્તિ કુશળતા પૂર્વક માણ્યુકશાહ શ્રેષ્ઠી પર ઢાલવવા માંડી. આચાર્યશ્રીના સુખ-પ્રહેશમાંથી વહેતી વક્ષધારાના વહેણુભાં માણ્યુકશાહશેઠનો કુળાચારધર્મ વહી જવા લાગ્યો.

વ્યાખ્યાન પરિપૂર્ણ થયું. માણ્યુકશાહનાં અંતરમાં ચાલતાં ધર્મચુદ્રનો નિર્ણય આવી ગયો. તેમણે તે જ વખતે જિલ્લા થઈ, પોતાના કુળધર્મને વીસરી જેઠને હેવહેરાસરનાં દર્શન તથા આંગીઉત્સવનો ત્યાગ કરી લોકાગચ્છનો સ્વીકાર કર્યો.

પોતાનું નિશાન બરાબર કારગત લાગેલું જેઠને સૂરિણું અંતર આનંદવેશથી નાચી જાઠયું.



## પ્રકરણ ત્રીજું

માતાનું હેત  
અથવા  
સતીનો સત્યાગહ

ઉજખયિની નગરીના ઉપરોક્ત જૈન ઉપાશ્રયથી અદ્ય  
અંતરે જ સુંદર અને સ્વચ્છ રાજમહાલયસમી એક વિશાળ  
હવેલી જિલ્લી હતી. એનાં પ્રવેશદ્વારમાં દાખલ થતાંની સાથેજ  
આંખ ઠરી બધ એવો એક નાનકડો રમણીય અગ્રીચો દષ્ટિ-  
ગોચર થતો હતો. બ્યવસ્થિત રીતે રાખેલાં મનોહર કૂલ  
આડાથી મહેક મહેક થઈ રહેલો આ ભાગ પોતાની શીતળ

સુગંધ સામેની હુવેલીના ખૂણે ખૂણામાં ભરી દઈને તેમાં રહેનાર વ્યક્તિત્વોનાં ભગજ તર કરી હેતો. એ માળની એ સાઢી સુંદર અને સુશોભિત દમારત સમસ્ત ઉજાયિનીમાં એક અનેરા નમૂના રૂપ ગણ્યાતી. એ હુવેલીને ઉપરે માળે આવેલા એક રમ્ય એઓરડામાં આજે એક માતાનું હૃદય રડી રહ્યું હતું.

“મા”-એ શાખદ માત્રમાં જ કંઈ અજખ જેવી ભીડાશ છે. “મા” એ શાખદોચ્ચારથી જ રહેંમાં જાણે અમૃતના ધૂંટડા ઉત્તરતા હોય એટલો આનંદ ઉત્પજ થાય છે. જે શાખદના મધુર રણકારથી કર્ણનિદ્રય પરિતુપ્ત બને છે, જેનો માત્ર નામોચ્ચાર જ હૈયામાં હેતના ઉમળકા આણી મૂકે છે એ માતાનું સ્થાન સમસ્ત વિદ્યની અમોલી વસ્તુઓમાં એક અને અદ્વિતીય છે. માતાનાં નાનકડાં હૃદયમાં રહેલો વાત્સલ્ય ભાવ પ્રદ્વાંડ લરમાં પણ ન સમાઈ શકે એવો વિરાટ છે. દુનિયાનાં તમામ બંધનો જ્યારે તૂટી જાય છે એવી આખરી ઘડીઓમાં પણ માતાનાં નામનો પરમ પવિત્ર ઉચ્ચાર લુહુવાએ રમી રહે છે. માતાના આવા અતુલ રનેહની જેઠી જગતમાં કૃયાંથી જડે ? આથી જ કવિ હૃદય પોકારી જડે છે કે:-  
“ જનનીની જેડ સખિ ! નહિ જડે રે લોલ ! ”

પુત્ર ગમે તેવો મહાપુરુષ હોય, કે પ્રતિષ્ઠાની પરા-કાણાએ પહેંચેલો હોય, છતાં માતાનાં હૃદયમાં એતું સ્થાન

એક ખાળક તરીકેનું જ હોય છે. માતાજીની આંખ, ઉંમર, પ્રતિષ્ઠા અને મહિસાનાં બાદાક આવરણોને લેટીને પોતાના પુત્રને બાલસ્વરૂપે જ નિહાળી શકે છે. અને આ કારણુથી જ પુત્રની ગંભીરમાં ગંભીર ભૂલ પણ માતાના ઉદાર હૃદયમાં સદા જર્વંદા ક્ષમાને પાત્ર હોય છે.

આજે આ હુદેલીના એકાંત ઓરડામાં રહી રહેલું માતૃહૃદય ઉજાયિનિ નગરીના નગરશોઠ માણેકશાહ શ્રેષ્ઠીની માતાનું હૃદય હતું.

જે પુત્રરત્નને આ માતૃહૃદયે બાહ્યાવસ્થાથી જ ધર્મનાં ધ્યાનથી પાયાં હતાં, જે બાલહૃદયની સુકોમળા જમીનમાં એણે ધર્મભાવનાનાં અમૂદ્ય ધીજ વાંચાં હતાં, જે પુત્રનાં જીવનમાં ઉમદા સંસ્કારોનું સિંચન કરવામાં એણે પોતાનો આત્મા નીચોવી નાખ્યો હતો, તે જ પુત્રને આજે ધર્મના સાચા માર્ગમાંથી ચચુત થએલો. જાણીને એ માતૃહૃદય પર જણે વજપાત થયો હોય, એવી સખત ચોટ લાગી હતી. સમસ્ત જીવનની તેની કમાણી જણે આજે એક જ દિવસમાં ધૂળધાણી થતી જતી હતી.

માણેકશાહ શ્રેષ્ઠીની માતા કસ્તુરખાનું સાગરહૃદય આજે ભયંકર વાવાજોડાથી ખળકણી ગયું હતું. માણેકશાહ પ્રત્યેનો અનો પુત્રપ્રેમ અથાગ હતો. જિંદળી ૬૨-

મિયાન એને એક પણ કઠોર શખદ કહેવાનો કોઈ ગ્રસંગ આયેલ ન હતો. દેશના ડાઢા માણુસો જેનાં ડહાપણુનો લાલ લેવા ઈચ્છતા, એવા ડાઢા અને કઢાગરા પુત્રની અચળ ધર્મ-ભાવનામાં આજ અચાનક આવો ગંભીર પલટો કેમ આવી પડ્યો તે એક કોચાડો હતો. આ કોચાડાનો ઉકેલ અશક્ય લાગતો હોવાથી માતાનાં અંતરની મૂંઝવણુનો પાર રહ્યો ન હતો. એની ઉલય આંખોમાંથી શ્રાવણું અને ભાદરવાનાં નીર વરસી રહ્યાં હતાં. પોતાના માર્ગબૂદ્ધા પુત્રને પાછો સત્ય-માર્ગે વાળવા એ મનમાં ને મનમાં શ્રી જિન પ્રભુની પ્રાર્થના કરી રહી હતી.

એટલામાં દાદર પર પડતાં કોઈનાં પગલાંનો અવાજ એના કણ્ણુંપટ પર અથડાયો. શારીરિક સ્વસ્થતા જગવવા તેણું તરત જ આંખોમાં ઉલરાઇ આવેલાં અશ્રુ પાલવની કોર વડે દૂધી નાખ્યાં.

તરત જ માણેકશાહ શેઠની ધર્મપત્ની લક્ષ્મીવહુ સાસુની સન્મુખ આવી જિલ્લી.

લક્ષ્મી વહુ ખરેખર લક્ષ્મીસ્વરૂપ જ હતી. સાસુના સ્નેહમાં તે માતૃપ્રેમનાં દર્શાન કરી શકતી. અને સાસુ પણ તેને પોતાનાં પેઠની પુત્રી પ્રમાણે જ ગણ્યતી. આથી આ સાસુ-વહુ વચ્ચેનો સ્નેહ માતાપુત્રી જેવો જ હતો,

“ કેમ એટા લક્ષ્મી ! શું કહે છે ? ” સાસુએ ચહેરા-  
પર છવાયલી શોકની રેખાઓને સ્થાને કૃતિમ હાસ્ય આણુ-  
વાનો વ્યર્થ પ્રયાસ કરતાં કહ્યું.

ચાલાક વહુ સાસુના શોકનો સંધળો લેદ પામી ગઈ  
હતી. માણેકશાહ શેઠની ધર્મભાવનામાં અચાનક આવી  
પડેલું પરિવર્તન સાસુનાં ભાવિક હૃદય પર કાતિલ અસર કર્યા  
વગર નહિ રહે. એ વાત વહુની ચેકોરદિથી છૂપી ન  
હોવાથી તે સાસુને લોજન માટે બોલાવવા આવી હતી.

“ માતુશ્રી ! રસોધ કયારની તૈયાર છે એ વાત તમે  
વીસરી ગયાં કે શું ? મને થથું કે તમે કોઈ જરૂરી કામમાં  
લોજનની વાત પણ ભૂલી ગયાં લાગે છો, એટલે અહીં  
બોલાવવા આવી. આપનાં કાર્યમાં કંઈ હરકત તો નથી  
આવીને ? ” વહુએ જાણે કંઈ જ બન્સું ન હોય એવી રીતે કહ્યું.

સાસુની લોજનની ભૂષ તો કયારની એ ભાગી ગઈ  
હતી. પરંતુ આ વાત વહુ પાસે શી રીતે વ્યક્ત કરવી તે  
તેને સૂઝતું ન હતું.

“ હા, ચાલો ! ” આટલું કહેતાં જ તે વહુ સાથે લોજન-  
ગૃહમાં આવી, અને પાટલા પર પોતાનું સ્થાન લીધું.

વહુએ પીરસેલી થાળી સાસુના પાટલા પર મૂકી.

“ વહુ એટા ! આજથી મેં એક નવીન પ્રતિજ્ઞા લીધી  
છે, ” સાસુએ વાતની શરૂઆત કરવા માંડી.

“નવીન પ્રતિજ્ઞા ? એ વળી કેવી !” વહું એ આશ્રી-  
અકિત થઈ જણ્ણાંથું.

“એ પ્રતિજ્ઞા એવી છે કે આજથી એં ધીર્ઘધનો સહં  
તર ત્યાગ કર્યો છે.” સાસુએ ઓમગોળા જેવી વાત વહું  
પાસે વ્યક્ત કરતાં કહ્યું.

આ વાત સાંલળી વહુંનું હૃદય જણે ઠરી ગયું. તેનું  
પ્રકાશમાન મુખમંડળ પ્રભાતના ચંદ્ર સમાન શીકું પડી ગયું.  
સાસુની આ ઉચ્ચ પ્રતિજ્ઞા સાંલળીને વહુંનું અંતર હુંઅનાં ફર્દી  
દ્વી ઊઠયું. તેની બંને આંખો તે જમણે આંસુથી છલકાઈ ગઈ.

“ધીર્ઘધનો ત્યાગ ! આવી દારુણ પ્રતિજ્ઞા શા માટે ?”  
વહું આંખો લૂછતાં પ્રક્ષે કર્યો.

“બિચારા ગરીબ લોકો જેમને જિંદગીમાં ધીર્ઘધનાં  
લાગ્યે જ ફર્શન થાય છે, તેઓ કેમ જીવી શકે છે એ મારે  
નેવું છે.” સાસુએ મુખથી સુદૂરે હુર કરતાં કહ્યું.

“સાસુજી ! એ લોકો ખાપડાં ધીર્ઘ વગર ચલાવી  
કેવાને ટેવાએલાં હોય, એટલે એમને ચાલી શકે, પરંતુ....”

“એ લોકો ટેવાઈ જાય છે, તેમ આપણાથી પણ શામાટે  
ન થાય ?” સાસુએ વહુંની વાતને અધવચભાંથી જ તોડી  
નાખતાં કહ્યું.

“બાઈજી ! આવી વૃદ્ધાવસ્થામાં આપ ધીર્ઘધનો ત્યાગ  
કરશો, તો શરીર શી રીતે ટકી શકશો ?” વહું એ દીનતા-  
પૂર્વક નવી વાત રજી કરી.

“ વહુ એટા ! આ શરીર તો માટીના ધડ જેવું ક્ષણું-  
લંગુર છે. જિન લગવાનને તે ટકાવવું હશે તો ટકાવશે. શરીર-  
સંપત્તિને ટકાવી રાખવાનો મારો મોહ તો ક્યારનોએ  
ચાલ્યો ગયો છે. ” સાસુએ અહગપણે ઉત્તર આપતાં જણાંયું.

સાસુને સમજાવવાના વહુના તમામ પ્રયત્નો આખરે  
નિષ્ઠણ નીવળ્યા. સાસુની અતિ સુકોમળ ધર્મભાવના પર  
એમના પ્રિય પુત્રના હ્યાથે જ લાગેલો જેરી જખમ જટવારમાં  
રૂઝાય એવો ન હતો. એટલે વહુની બધી સમજાવટ વ્યર્થ  
નાય એમાં નવાઈ નહિ. વહુની આવી અસીમ લાગણી અને  
અનહુદ લક્ષ્ટિભાવ જોઈને સાસુનો અંતરાત્મા સંતુષ્ટ  
થયો. અને એણે પોતાની તમામ હૃદયવ્યથા વહુની પાસે  
સ્પષ્ટ સ્વરૂપે વ્યક્ત કરી દીધી. માણેંકશાહના હાલના વલણ્યથી  
એમનાં ધર્મપત્નીના મનને પણ ઓછો આધાત નહોતો લાગ્યો.  
એટલે સાસુવહુ બંનેનું હર્દી એકજ હતું. આ દર્દીનો યોગ્ય  
ઇલાજ મળી આવે ત્યાં લગીને માટે માણેંકશાહનાં  
ધર્મપત્નીએ પણ સાસુ ન જાણી શકે તેમ સાસુની પ્રતિજાનું  
પોતે પણ પાલન કરવાનો મન સાથે દર્દ નિશ્ચય કરી દીધો.



## પ્રકરણ ચોથું



### શુભાગમન

રૂત્રિહેવીએ પૃથ્વીના પટ પર પાથરી દીધેલો અંધાર-  
પિછાડો ગુપ્ત્યુપ ખસેડી લેવા માંડયો હતો. ર્પોટ્ય કુટતા  
પર્પોટાએ અદશ્ય થઈ જઈને જેમ સમુદ્રની અસીમ સ્થા-  
મતામાં એકાકાર થઈ જાય, તેમ આકાશના તારલાએ એક  
ખી એક અનંત આકાશની શૂન્યતામાં ફરી એકવાર અદશ્ય  
થતા જતા હતા. અંધકારના અનંત આવરણુને લેહી દઈને

દેવ ૧પ્રલાકરનાં પ્રકાશકિરણો કોઈ વિજેતા સેનાધિપતિના આગળ ધસતા સૈન્યની માફક વધુ ને વધુ વિસ્તરતાં જતાં હતાં.

વનપણુંચોની વિકરાળ ગ્રાડોથી આખી રાત ગળું રહેલું વિકટ વન હુમણાં જ જરા શાન્તિને પામેલું હતું. આડે આડે અને ડાળે ડાળે કલોલ કરતાં વનપણીઓ વિવિધ પ્રકારના એકધારા નાદ વડે સમય જંગલ ગજવી રહ્યાં હતાં.

પ્રેમીની ગોદમાં લાન ભૂલીને આખી રાત કેદી અનેદો લોણીભર કમળપુણ્યની ઝૂલતી પાંખડીઓ વચ્ચેથી, પ્રણયિ-નીના પ્રેમપાશમાંથી ઊડતા કોઈક પ્રણયીની જેમ અન્યવસ્થિત હાલતમાં આળસ મરદીને ઊડતો હતો. કમળકુસુભો ફરી એકવાર પોતાની અનેક પાંખડીઓ પ્રસારીને ઘીલી ઊઠ્યાં હતાં, અને સરોવરજળમાં હીંચતાં હીંચતાં એકી-ટસે મીઠ માંડીને ૩સવિતાહેવનાં દર્શન કરી રહ્યાં હતાં.

પ્રલાતના પ્રકાશથી અથકીને જાગી ઊડેલા મુસાફર લોકો, આખી રાતના આરામથી તાજ થએલા હોવાથી, મુસાફરીનો તૂટેલો તંતુ સાંધીલેવાની તૈયારીમાં પડેલા હતા. શીતળ, મંદ, અને સુગંધી સમીરથી સમસ્ત જંગલ મધમધી ઊડયું હતું વનતરુષરોની વિશાળ ડાળીઓ પવનની લહેરોથી ઝૂલતી ઝૂલતી, રમણીય અંગમરોડથી રાહુદારીઓને સત્કારી રહી હતી.

---

૧ સૂર્ય ૨ સુર્ય

આ સમયે એક નાનકડું થતિમંડળ ઉજજયિની નગરીને માર્ગ શાન્તિપૂર્વક પ્રયાણ કરી રહ્યુ હતું. તમામ સાધુઓ શરીરે મહુ જેવા મજબૂત હતા. જૈન સાધુઓએ પગપાળા વિહાર કરવાનું ધાર્મિક બંધારણ અનેક રીતે ઉપયોગી નીવડે છે. આમ અનાયાસે મળી જતો વ્યાયામ લગભગ દરરોજના કાર્યક્રમમાં નિયમિતપણે નિયત થએલો હોવાથી એમના શરીરનો બાંધી સર્વ પ્રકારે સુદઠ બનેલો હતો. વળી ચાલવાનું હંમેશાં ઝુદ્ધા પગે જ થતું હોવાથી, તેમનાં પગનાં તળીઓં એવાં તો મજબૂત બની ગયાં હતાં, કે રસ્તે ચાલતાં કોઈ કાંટાને લોાગ જેગે એમના પગ સાથે ભટકાવાનો પ્રસંગ પ્રાપ્ત થાય, તો તેને પગની અંદરના પ્રહેશમાં પ્રવેશ કરવાનો માર્ગ મળવાને બદલે ભાંગીને ભૂષ્ણો થયે જ છૂટકો થતો. પગે ચાલવાની આ નિયમિત કસરતને લઈને તેમજ અધ્યાત્મિક લિઙ્ગને એમના આરોગ્ય પર એક પ્રકારની અદ્ભુત અસર થએલી જેવામાં આવતી હતી. આથી તેઓ લાગ્યે જ કહી ધીમારીનો લોાગ બનતા.

શરીરની અંદર સોંસરા પેસી જાય એવા શિશ્વાળાના શીતળ પવનો, અને મોઢાને બાળી નાખે એવી ઉનાળાની ધગધગતી દૂના પ્રચંડ અપાઠ તેઓ હંમેશાં પોતાના શરીર-પર જીવતા હોવાથી પલટાતી જગતુઓના શાંતોષ્ણુપ્રવાહે એમના વજ જેવા હેઠ પર સહેજ પણ અસર કરી શકે

એમ ન હતું. નિયમિત વ્યાચામ અને અખંડ પ્રકૃત્યાર્થના પાલનને લઇને એમનાં શરીર જાણે કોઈં ડનાં જ બની ગયાં હતાં.

કડકડતી ટાઠ અને ધગધગતા તાપ જેમ એમના દેહ પર અસર કરવાને અસરમર્થ હતાં, તેમ સંસારનાં સુખદુઃખ અને મોહમાયા, તપત્યાગ અને વૈરાગ્યના તાપથી શુષ્ક બની ગયેલા એમના માનસિક પ્રવેશમાં લાગ્યે જ કહી પ્રવેશ કરી શકતાં.

દરેક યતિમહારજની અગલમાં જૈનધર્મની અહિંસક વૃત્તિનું સૂચન કરતું અકેક રનોહરણ દળાવી રાખેલું દશ્િ-ગોચર થતું હતું. ઉપરાંત દરેકના હુસ્તમાં અકેક લાંખી અને મજઘૂત જેણિકા જેતાં અહિંસામાં પણ જેણિકાની અનિવાર્ય આવર્થયકતા છે એવો લાસ થયા વિના રહેતો નહિ. બીજા હાથમાં અકેક સુહુપત્તી રહી ગયેલી હતી, જે વાત કરતાંની સાચે જ અનાયસે મહેંપર આવી જતી. હવામાં રહેલા અસંખ્ય સંપાતિમ વસળુવેનો વાત કરવાથી પણ વિનાશ ન થાય, એવી અતિ સૂક્ષ્મ અહિંસા સુધી ઊડા ઉત્ત્રવાની જૈનધર્મની ઝીણુવટ લેઇને કોઈના પણ હૃદયમાં તેને માટે માન ઉત્પત્ત થયા વિના રહે તેમ ન હતું.

દરેક સાધુના પૃષ્ઠલાગ પર સ્કંધ પાસે જાનની પરમ સમાં ધર્મપુસ્તકો અને પાના એક કપડાવડે લપેટીને

મજખૂત બાંધી કેવામાં આવ્યાં હતાં. આ જેઠને જાણે એક જીવતું પુસ્તકાલય જ ચાલયું આવતું હોય એવો ઘડીલર વિચાર આવ્યા વિના રહેતો નહિ.

જરા ગીણી દિષ્ટિથી જેનાર તરત જ સમજુ જાય એમ હતું, કે એ યતિમંડળમાં એક આચાર્યશ્રી હતા અને અન્ય સૌ એમના શિષ્યો હતા.

પ્રત્યેક યતિ મહારાજના સુખમંડળ પર ત્યાગ, વૈરાગ્ય અને તપશ્ચયોની ઉત્કૃષ્ટ લાગણીએ દિષ્ટિગોચર થતી હતી. ઉપરાંત આચાર્યશ્રીની આંખમાં ચમકી રહેલી જાન અને જુદ્ધિની ચમક પણ જેનારને પ્રથમ દિષ્ટિએ જ મુખ કરી નાએ એવી અજબ હતી. એમનું મોદું ચકચકતું કપાળ ઊડા અસ્થાસ અને પરિશીલનની સાણીતી આપી રહ્યું હતું. નાકનો વળાક વિચારોની દફતાનું સૂચન કરી રહ્યો હતો. ધર્મપ્રેમની પ્રભર તેજસ્વિતા એમના સુખમંડળની રેખાઓ રેખાઓ રમી રહી હતી.

આચાર્યશ્રીનું નામ હેમવિમળસૂરિ હતું. શ્રી પરમ પૂજય મહાવીરસ્વામિના નિર્વાણુ પદ પણી લાંબા સમયને અંતરે પંચાવનભી પાટે શ્રી તપગચ્છ બિરુદ્ધ ગચ્છાધિરાજ શ્રી હેમવિમળસૂરિ \*આચાર્ય થયા. એ આચાર્ય શ્રી આજે પોતાના શિષ્યવૃંદ સહિત ઉજ્જવિની નગરી તરફ વિહાર કરી રહ્યા હતા.

આ યતિમંડળ થોડા દિવસ ચડતાં જ ઉજજયિનીને પાછરે આવેલા એક ઉપવનમાં આવી પહોંચ્યું. અહીં એક શાન્ત એકાંત સ્થળમાં એમણે થોડા દિવસ વાસો કરવાનો નિશ્ચય કર્યો.

યતિહેવોના શુભાગમનના સમાચાર વાયુવેગે ઉજજયિની નગરીમાં ફરી વળ્યા.

આચાર્યશ્રીની શાન્ત, સૌમ્ય મુખમુદ્રા, એમની વાણીમાં વહેતો અખંડ ઉપહેશપ્રવાહ, તેમજ એમના ત્યાગ, વૈરાઘ્ય, અને જ્ઞાનની ચર્ચા ઉજજયિની નગરીની ગલીએ ગલીએ ચાલવા લાગી. મહારાજશ્રીની શક્તિ અને લક્ષ્મિની પ્રશસ્તિ કર્ણીપ્રકર્ષું સારાથે શહેરમાં પ્રસરી ગઈ. આથી આચાર્યશ્રીનાં હર્થન અને વંદન માટે ભાવિક શ્રાવક શ્રાવકાઓનાં ટોળેટોળાં આશ્રમ તરફ ઉલટવા લાગ્યાં.




---

\* આચાર્યશ્રી હેમવિમળમરિના સમયમાં શ્રી જિનશાસન અંતર્ગત ત્રણું ગયા જુદા થયા. કમળકળસા, કનકપુરા અને કડવામતિ

## ગ્રંથાણુ પ સું

ઘટસંક્રાટ

“સાચુલ ! વધામણી ! વધામણી !” માણ્યેક શાહનાં ધર્મપતની લક્ષમીવહુ અતિ ઉમળકા લેર પોતાની સાચુ સમક્ષ ઉપરોક્ત શાખાઓચ્ચાર કરતી આવી ગિલ્લી.

“વહુ એટા ! શાની વધામણી ? શું મારો પુત્ર....”

“ના માલુ ! એવું તો હજુ કંઈ નથી, પણ આજે આપણું ધન્યલાગ્ય કે ઉજાયિની નગરીને આંગણે મહા-પ્રતાપી આચાર્ય શ્રી હેમવિમળસ્તુરિનું આગમન થયું છે.”

મને તો એમાં ઈશ્વરી સંડેતનાજ હર્ષન થાય છે. વહુએ સાસુનાં વાક્યને અધવચ્ચેથી ઉડાવી હઈને વધામણીનું સાચું કારણ વ્યક્ત કરતાં કહ્યું:

“ વહુ બેટા ! તમારી વધામણી તો શુદ્ધ સોના જેવી છે પણ.....”

“ એ પણ ની વાત પછી. પ્રથમ તો આપણે આચાર્ય-શ્રીની આપણે ઘેર પધરામણી કરાવીએ; એટલે એમની કૃપાવડે પાણીને રસ્તે પાણી થઈ જશે એવી મારી સંપૂર્ણ શક્ષા છે. ”

“ બેટા ! એ બધી વાત તો સાચી છે, પણ જ્યાં ઘરનો મુખ્ય માણુસ તારો પતિજ ફરી બેઠો છે, ત્યાં પધરામણી પણ શી રીતે થઈ શકે ? ”

“ મા જી ! એમ નહિ બાલો. મારા પતિ તો પછી; પ્રથમ એ આપના પુત્ર છે, એ વાત કેમ વીસરી જાઓ છે? આપનું વચ્ચેન એ ત્રણે કાળમાં કદ્દી પણ ઉથાપવાના નથી. આપના એકજ શાખદથી એમની બધી ભ્રમણું લાગી જશે એવી. મને તો પૂરેપૂરી આતરી છે. ”

“ દીકરા ! મને તો એમ થવું અતિ મુશ્કેલ લાગે છે. મારી આજાની જ્યાં ખુલ્લી અવગણુનાજ હેખાતી હોય, ત્યાં ફરી એજ આજા કરવાનો અર્થ પણ શો ? ”

“ મા જી ! ધીરુધના ત્યાગથી શોઢ દિવસમાં જ આપનું શરીર અધુર્એ થઈ ગયું છે, અને આવી સ્થિતિ વધુ વખત લંબાય તો કોણું જાણે શું થાય ? ” વહુની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યાં.

“ મને કશું નહિ થાય; દીકરી ! મારી ચિંતા અખિલકુલ કરીશ નહિ. આખી સુધિને કયાં ધીરુધ મળી શકે છે ! હતાં એ તમામ લોકો જીવી રહ્યા છે ને ! હું કંઈ એમ ઓછી જ મરી જવાની છું ! ”

“ કેમ કોણું મરી જવાનું છે ? માતાજી ! આમ કેમ એલો છો ? ” માતાના શાળદો સાંલળી આશ્ર્યાચહિત થઈને માણેકશાહ શેડે આવતાં વેતજ પ્રક્ષે કર્યો.

“ કશું નહિ બાપુ ! એ તો અમસ્તું જ. ” માતાએ મૂળ વાતને ઉડાવી હેતાં કહ્યું. ” એમ તો નહિ જ અને સાસુલુ ! આ વાતો હવે વધુ વખત ગુજરાત રાખવી યોગ્ય નથી. પૂછવા-વાળા જ્યારે મોટામોઠ આવી પૂછે, ત્યારે આવી વાત દખાવી હેવામાં શો સાર છે તે સમજનું નથી. માટે કાં તો સાચી વસ્તુસ્થિતિથી એમને વાકેઝ કરો, અથવા તો મને તેમ કરવાની અનુઝા આપો. ” લક્ષ્મીવહુએ આવી અમૃત્ય તકનો લાલ જતો ન કરવાનો નિર્ણય કરી ચોતાનો અલિગ્રાય ઝુલ્લી રીતે પ્રકટ કરતાં કહ્યું,

સાસુની પરિસ્થિતિ હવે વિષમ થઈ પડી. આવા ધર્મસંકટના સમયે શી રીતે માર્ગ કાઢવો તેનો વિચાર કરતાં તે સુંઅધ પણ્યાં.

માણુકશાહ શેડ પણુ પોતાની ધર્મપત્નીના ઉપરોક્ત શબ્દોથી હિંગ થઈ ગયા. એ પણુ સમજુ ગયા, કે અવસ્થય કંઈક અધિત ધરના અની છે.

માતાના સુખમંડળની રેખાએ રેખાએ લયંકર દર્દ ભરેલું જોઈને, માણુકશાહની માનસિક મૂંઝવણુનો પાર રહ્યો નહિ. માતાને ચરણે પડી એમણે ગળગળા અવાજે કહ્યું.

“ માણ ! એ હોય તે સુખેથી કહો ! આપની આજા મસ્તક પર ચઠાવવાને સેવક હાજર છે. ”

માતાની આંખમાંથી દડદડ કરતો અશ્વુપવાહ એકધારે વહી રહ્યો. અંતરમાંથી બહાર નીકળવા મથતો. અવાજ એમના ગળામાં જ ગુંગળાઈ જઈને ત્યાં જ વિલીન અની ગયો. એક પણ શબ્દ માતાના સુખમાંથી બહાર આવી શક્યો નહિ.

માતાના અહેરા પર ઉલ્લાધ રહેલું દર્દ વ્યાકુળ હૃદયે નિહાળતા માણુકશાહ શેડ જડવતુ જિલ્લા હતા.

હવે જ અરેખરી તક હાથમાં આવી છે, એ જોઈને લક્ષ્મીવહુએ સમય પર સોગડી મારવાનો નિર્ધાર કરી લીધો,

“ બા પ્રત્યેનો આજે આટલો બધો ભક્તિભાવ ઉલ્લાસ જાય છે, પણ કદી જેણું છે, બા તું શરીર અધું થઈ ગયું છે તે ? ”

આ શબ્દોએ માણેકશાહ શેડના અંતરમાં ધરતીકંપ જગાવી દીધો. માતાનું શરીર આટલું બધું લેવાઈ ગયું છે એવો કદી જ્યાલ પણ માણેકશાહ શેડને આજ લાગી આવ્યો ન હતો. આજે જ એકાએક માતાના સુખમંડળનું નિરીક્ષણ કરવાનો અવસર આવતાં તે એકદમ પૂરુણ ઉક્ખા. આનો લેદ જાણવાને એમના અંતરમાં તાવાવેલી લાગી. એમણે તરત જ બધી વાત સ્પષ્ટપણે જણ્ણાવી હેવાની એમની ધર્મ-પત્નીને દર્દીંખીર હૃદયે આજા કરી.

“ પરંતુ એથી બાના મનને માડું લાગશે તો ! ”  
વહુએ વાતમાં વધુ મોણું નાખવા માંડયું.

“ હવે જે ક્ષણ વ્યતીત થાય છે તે પણ મારે માટે અસહ્ય થઈ પડે છે. માટે સાચી વસ્તુ સ્પષ્ટ કરવામાં વધુ વિલંબ કર્યો હવે ઉચિત નથી.” માણેકશાહ શેડ પોતાના હૃદયની અકળામણ વ્યક્ત કરતાં કહ્યું.

“ જુઓ, સાંભળો ત્યારે ! તમે હમણું કોઈપણ દિવસ આને લોજનમાં ધી કે હૃદ લેતાં જેયાં છે ખરાં ? ”

“એટલે ? ” માણેકશાહ શેડની અધીરતા પળે પળે વધવા

લાગી. “એટલે એ જ કે બા એક ગરીયમાં ગરીય માણુસની માઝે આજ કેટલાએ દિવસ થયાં આજરાનો રોટલો અને મિઠાની કાંકડી પર ચોતાના હેહને ટકાવી રહ્યાં છે.”

માણુકશાહ શેઠને લણે પગ નીચેથી ધરતી સરી જતી હોય એવું લાગ્યું. એમનું મસ્તક ચઙ્ગર ચઙ્ગર ધૂમવા લાગ્યું. માતાએ આ ઐચ્છિક ગરીયી વહેારી લેવાનું કારણ એ અરાખર સમજી શક્યા નહિ.

“આ ધીર્ઘ નથી ખાતાં, એ વાત તમે પણ આજ દિવસ લગી મારાથી શામાટે ધૂપાવી રાખી?”

“આની અનુજા વિના એમની કોઈ પણ વાત આપની પાસે ખુલ્લી કરવાનો મને શો અધિકાર હોઈ હો ?”

“આ તો ગજાય કહેવાય ?” માણુકશાહ શેઠ ચોકારી ઉઠ્યા.

“ગજાય પર તે વળી કંઈ શીંગડાં થતાં હોય છે? જુઓ, હમણાં માત્ર તમારા ભોજનમાં અને સાધુસાધી વહેારાવવા પૂરતું જ ધી અને ધીની વાનીએ આપણું ધરમાં વપરાય છે.” ચાલાક વહુએ એવો જ જીલે ધડકે કર્યો.

“શું ત્યારે તેં પણ ધીર્ઘને ત્યાગ કર્યો? લલા માણુસ ! તમે બધાંએ આ શું કરવા માંડયું છે ! ત્યારે શું મારી એકની જ આંખો બંધ થઈ ગઈ છે ?”

લક્ષ્મીવહુનાં છેલ્લાં વાક્ય થી કસ્તુરખા પણ એકાંગે  
અમંકી ગયાં.

“વહુ, ત્યારે તો તેં પણ હુદ કરી. શું મારી સાથે  
તેં પણ ધી દ્વારા તળ દીધું ? અને મેં પણ આંખો  
મીંચેલીજ રાખી ? તેં તો અરેખર મારા માથાપર મરી  
વાટયાં.” સાસુએ વહુને વહાત લયો ઠપકો આપતાં  
જણાંયું.

“પણ આ બધી શી અટપટ ચાલી રહી છે, અને  
અંતે તમે બધાં શું કરવા બેડાં છો તે હું તો કશું સમજ  
શકતો નથી.” માણેકશાહે વ્યાગ્રહૃદયે જણાંયું.

“જે વસ્તુના ખાસ કારણભૂત ખુદ તમે જ છો, તે  
તમે પોતેજ જે ન સમજ શકો, તો બીજું કોણું સમજ  
શકે ?” લક્ષ્મીદેવીએ મૂળ વાત પર આવતાં જણાંયું.

“શું હું જ કારણભૂત ? લક્ષ્મી ! આ તું શું એલે છે ? ”

“તમે નહિ તો બીજું કોણું ? જે દિવસથી તમે હેવ-  
દેરાસરનાં દર્શાન્પૂજનથી હૂર થયા છો, તે જ દિવસથી  
તમારો ધર્માંતરલાવ લેઇને માતાલુએ ધીદ્વધનો સદંતર  
ત્યાગ કર્યો છે.”

“ મારો ધર્માત્મા લાવ થયો જ નથી. જિનભગવાનથી હું લેશ પણ વિમુખ નથી. માત્ર પ્રતિમાપૂજન અને આંગીઉત્સવમાં મને હુવે આત્મકલ્યાણ નથી હેખાતું. ”  
માણ્યોકશાહે પોતાની વર્તણું રસ્ત કરતાં હછું.

“ એ તો જેવી ભાવના તેવી સિદ્ધિ ” માણ્યોકશાહનાં માતુશ્રી એલી ઊક્યાં. “ હેવહેરાસર અને પૂજનઅર્થનનો અવગણ્યના કરીને પછી આત્મકલ્યાણ શોધવા ક્યાં જવું? ”

“ પરમપૂજય માતુશ્રી ! આપની વાત ટીક છે. પરંતુ હડીકર એ છે, કે મતમતાતંત્રના વાદવિવાદથી મારું મન સત્યવસ્તુની પ્રાપ્તિ નથી અતુલવતું. વળી ઉત્સવ-આંડભરોમાં મને તો કેવળ કર્માંધન અને કાળજીપજ જેવામાં આવે છે. ” માણ્યોકશાહે પોતાના અંતરનો લાર ખાલી કરતાં જણ્ણાંયું.

“ ભાઈ, આટલા ખધા જાડા ઉત્તરવામાં અને આટલી જીણી દદિઓ જેવામાં શું સાર છે ? માનવપ્રાણીને જ્યાં-સુધી એ આંખો છે, ત્યાંસુધી તે પ્રતિમાપૂજનથી કઢી પણ અલગ થઈ શકવાનો નથી. વાડા જુહા છે, રસ્તા અનેક છે; પરંતુ જિન ભગવાન એક અને અખંડ છે. શ્રી શાન્તિનાથ પ્રભુની સાધના-આરાધના એ જ એક સત્ય માર્ગ છે. ”

માતાએ માર્ગબૂલેલા પુત્રને ધર્મનું સાચું અને શુદ્ધ સ્વર્ણપ  
સમજાવતાં કહ્યું.

“ પરમ તીર્થર્ણપ પ્રાતઃસ્મરણીય માતુશ્રી ! આપની  
આજા મને સહા સર્વદા શિરોમાન્ય છે.” માણેકશાહે  
સંદેશપમાં જ પતાઠયું.

પુત્રના પ્રેમભર્યો શાખ્યોથી માતાના આનંદનો પાર રહ્યો  
નહિ. તેના શુદ્ધ શરીરમાં નવજીવનનો સંચાર થયો.

“ તો આજે જ આપણું પૂજ્ય આચાર્ય શ્રી હેમવિમળ-  
સૂરિની આપણે ત્યાં પદ્મરામણી કરાવીએ, એટલે માતાજીના  
મનનું સંપૂર્ણ સમાધાન થઈ જશે એવી મને પૂરી ખાતરી  
છે.” લક્ષ્મીદેવીએ તક જોઈને નવી હરખાસ્ત રણુ કરી.

“ બસ, એજ ને ! એમાં તે શી મોટી વાત છે ?  
હું આજે જ એ વિષયમાં યોગ્ય તજવીજ કરું છું ?”

આટલું કહેતાં જ માણેકશાહ શેડ માતુશ્રી કસ્તુરભાનાં  
અરણ્ણોમાં કરી એકવાર વંદન કરીને વિદાય થયા.

પુત્રનો પોતા પ્રત્યેનો આવો અદ્ભુત ભાવ જોઈને મા-  
તાનું હૃદય આનંદાવેશથી નાચી ઊઠયું. એમનું અંતર એ  
માતૃલક્ત પુત્ર પ્રત્યે આશીર્વાદના વરસાદ વરસાવવા લાગ્યું.

માતાતું સુકોમળ હૃદય લાગણીઓના ભારથી દ્રવી ગણું.  
અમની આંખોમાંથી એ ચાર સ્નેહનાં આંસુ ટપકી પડ્યાં.

મનમાં વિચાર આવ્યો, કે “જેને વેર માણુંકશાહ  
જેવો આશાંકિત પુત્ર અને લક્ષ્મીહેવી જેવી સુશીલ અને  
શાણી વહુ હેઠાય તેના જેવો ભાગ્યશાળી જગતમાં જીને કેાણ  
કહેવાય !”



## પ્રકરણ છું

### કસોટી

જૈનધર્મ એ જગતના મહાલ ધર્મોમાંનો એક મનાય છે. દેશવિદેશના અનેક ધર્મજિલાસુઓએ જૈનધર્મના સચેતૃપુષ્ટ લિઙ્ઘાંતો અને અનેરા આદશો આગળ પોતાતું ભસ્તાક ઝુકાયું છે. જૈનધર્મની શ્રેષ્ઠતા અને મહત્તાતું સુખ્ય કારણ એ છે કે, તેનું મંદાણુત્યાગ અને વૈરાઘ્યના મજબૂત પાયા જી થશેલું છે. જૈનધર્મનું એટલે ત્યાગ અને વૈરાઘ્યની વાદ્ય મૂર્તિં. તથ અને ત્યાગ એ તેસ એમની રગેરગમાં વધુાઈ ગણેલા હોય છે. ધર્મનું એ હરકોઈ ધર્મનું એક

અમોદું ધન છે. જૈનધર્મની વ્યાપકતા પણ સુખ્યતવે એ ધર્મગુરુઓની તપત્યાગની શક્તિને આભારી છે. પ્રાચીન કાળમાં ભારતવર્ષમાં અનેક રાજમહારાજાઓના દરખારમાં એમનું સ્થાન અદ્વિતીય હતું. માંધાતા મહીપતિઓ એમના ચરણારવિંદમાં પોતાનું મસ્તક ઝુકાવવામાં જોરવ માનતા. આજે પણ જૈન ધર્મોચાર્યની એ અદ્વલુત તાકાત અવાર નવાર ફિટગોચર થયા વિના રહેતી નથી.

આચાર્યશ્રી હેમવિમળસુરિ પણ એવા જ એક મહાન શક્તિશાળી ધર્મગુરુ હતા. એઓશ્રી તપગચ્છમાં એક સમર્થ વિક્રાન હતા. જેવા વિક્રાન હતા તેવા જ તેઓ ત્યાગી અને તપસ્વી હતા. તપ અને ત્યાગથી તાવીતાવીને તેમણે તન, મન પર, વિજ્ય પ્રાપ્ત કર્યો હતો. એમનો શિષ્યસમુદ્દાય બહેણો હતો. અને અનુયાયીઓનું પ્રમાણુ તો અતિશય વિશ્વાળ હતું. એમના વ્યક્તિત્વની તેજસ્વિતા, વાણીની મૃહૃતા અને ધર્મપ્રિયતાને લીધે એઓ જ્યાંજ્યાં પગ મૂકતા, ત્યાં ત્યાં રાજમહારાજને પણ હુલ્લાલ એવા અનેરા આદરસ્તકારને પ્રાપ્ત કરતા. જૈન અને જૈનેતર સમાજમાં પણ એમનું સ્થાન અત્યંત ઉચ્ચ અને અદ્વિતીય હતું.

આચાર્યશ્રી હેમવિમળસુરિ ભાવિઠ જીવોને પ્રતિષ્ઠાય આપતા, અને જ્ઞાનપ્રકાશ વડે અજ્ઞાનતિભિરને દૂર હટાવતા. ભારતવર્ષના વિધવિધ પ્રહેણોમાં વિચરી રહ્યા હતા. આજે

એઓશ્રી ઉજઘયિની નગરીની સમીપમાં આવીને સમોસ-  
રી છે. નગર બહારના એકાંતવાસમાં એક શાન્ત અને  
નિરૂપદ્રવ સ્થાનમાં કાઉસગ્ગ ધ્યાનમાં એડા છે.

આચાર્યશ્રીનાં દર્શન અને વંદન માટે આપો હિવસ  
ઉલ્લેખાં ઉજઘયિનીવાસીઓનાં ટોળાં સંદ્યા સમય થતાં  
ઓછાં થતાં જતાં હતાં. થોડો વધુ વખત વ્યતીત થતાં  
આચાર્યશ્રીના આશ્રમમાં નીરવ શાન્તિ પથરાઈ ગઈ. આચા-  
ર્યશ્રી અને એમનો સાધુસમુદ્દાય સે. કોઈ આ વખતે ધ્યાન-  
મળ હતા.

આ સમય સાધીને ઉજઘયિની નગરીના નગરશૈઠ  
માણ્યુકશાહ શ્રેષ્ઠી આચાર્યશ્રીના આશ્રમમાં આવી પહોંચ્યા.  
એઓ આજે આચાર્યશ્રી હેમવિમળસુરિના શુણુઝાનની કસોટી  
કરવાનો નિશ્ચય કરીને આંદ્રા હતા.

માણ્યુકશાહે પ્રથમથી જ કૃપડાના એ કાકડા તેલમાં  
ભીજવીને તૈયાર કરી રાખ્યા હતા. આ અંને કાકડા સળ-  
ગાવીને એમણે જાગૃત કર્યો. આચાર્યશ્રી જેમના તેમ શાન્ત  
એડા હતા.

અંને હાથમાં ભડલડ બળતા એ કાકડા લઈને માણ્યુક-  
શાહ શેઠ મહારાજશ્રીની સમીપમાં આવી પહોંચ્યા. ઉભય  
હુસ્તમાં જલતા રહેલા કાકડાનો કરડો પ્રકાશ આચાર્યશ્રીનાં

મુખમંડળ સમક્ષ ધરીને એમની મુખાદૃતિનું બારીકપણે એ નિરીક્ષણું કરવા લાગ્યા. આ રીતે વારાફરતી કેટલીએવાર તે તમામ થતિઓની સન્મુખ પ્રકાશ સહિત ફરી વળ્યા. સદાનું અંધકારમય સ્થાન આજે એકાએક તેલિયા કાકડાના તેજસ્વી પ્રફાશ વડે પ્રકારી જઠણું.

લડકે બળતા કાકડાએનો પ્રકાશ અનેકવાર આંખો સમક્ષ આવવા છતાં આચાર્ય અને એમનો થતિસમુદ્દાય એટલા તો ધ્યાનમઞ હતા, કે માણેકશાહની આ ઉપહાસ-કિયા તેમજ આવી અવહેલનાયુક્ત પરિચ્યો તેમના કાઉસગ્ગમાં યતકિંચિત પણ વિક્ષેપ ઉત્પન્ન કરવાને સર્વથા અશક્ત નીવડી. સમ્યગ્રધ્યાનમાં ગ્રમત્ત બનેલા મહાત્માઓના હૃદયકભળની એક પણ પાંદડી હલાવવાને આ તમામ કિયા નિરૂપયોંગી હતી.

માણેકશાહે કરેલી આ કપરી કસોટી તો પરિપૂર્ણ થઈ. પરંતુ તેની સાથે તે પશ્ચાત્તાપનો એક જેરી ડંખ માણેકશાહ એઠીનાં સુ કોમળ અંતઃકરણમાં સદાને માટે મૂકૃતી ગઈ.

આજની રાત માણેકશાહ ઘેઠને માટે કાળરાત્રિ સમાન નીવડી નિકલ્યેલી આજે એમનાથી રીસાઇને ફૂર ફૂર નાસી ગઈ હતી. પશ્ચાત્તાપનો કીડો આજે એમનાં અંતરને જાંડે ઉંદેશી કરી કોરીને ખાતે હતો. સ્ફૂર્તાં સરોવરમાં જેમ જા-

ઇથી તરફડે તેમ માણેકશાહ શેઠ આજે સુંવાળી તળાઈ-ઓવાળા છત્રીપલંગમાં તરફડી રહ્યા હતા. અનેક તરેહના વિચારતરંગો એમનાં હૃદયપટ પર ચિત્રપટની પેઠે ચાલતા હતા.

“ અહો ! આજે મને આ કેવી કુમતિ સૂઝી ! આવા સપરિણ્ણામી સમદાષ્ટિ સિદ્ધ મહાત્માની મેં આજે કેવી ભય-કર મશ્કરી કરી ! રાગદેખાદિરહિત તેમ જ વિષયકથાયથી પર એવા જિતેન્દ્રિય યતિમહારાનેના સૌભ્ય સૌભ્યગ્રભાવની મેં મૂર્ખશિરોમણિએ આજે આ કેવી હાંસી કરી ! ઘિંજાર હણો, મારી એ અધમ વૃત્તિને ! આવી અવળી મતિ કોણું જાણે મને કયાંથી આવી ! હું આજે આમ અધોગતિને આરે કેમ આવી જાલો ! ”

“ હે પરમ પરમાત્મા ! જિનશાસન હેવ ! હે અરિહંત ગ્રલુ ! આવા નિઃસ્વાર્થી નિશ્ચાય મહાત્મા જે સ્વયંતરવાને અને મારા જેવા અનેક અભાગી જીવોને તારવાને સમર્થ છે, એવા એક મહાપુરુષની કંઈ પણું કારણું વગર આવી કૂર મશ્કરી કરવાના અધોર પાપમાંથી હું કોણું જાણે કરે લવે ધૂઠીશ ! ”

માણેકશાહની આંખોમાંથી પસ્તાવાનો અવિરત અશ્વ-પ્રવાહ વહેવા લાગ્યો. એમનું મનપણી જાડી જાડીને શાન્તિ-સ્વરૂપ આચાર્યશ્રી હેમવિમળસ્વર્ણિનાં ચરણોમાં આયોટવા લાગ્યું. કયારે સવાર પડે અને કયારે એ મહાપુરુષની મારી

માણું એવી અતિ તીવ્ર તાલાવેલીથી માણુકશાહનું અંતર તલપાપડ થવા લાગ્યું.

આજની રાત્રો માણુકશાહ શેડ માટે જુગના જુગ જેવી અતિ લાંબી થઇ પડી. માખણું જેવી સુકોમળ તળાઈઓ આજે એમનાં અંગેઅંગમાં બાણુશચ્યાની માર્ક ઝૂંચવા લાગી.

આમને આમ અશ્વ, રૂદ્ધન અને પશ્ચાત્તાપના અતિ વેગવાન પ્રવાહમાં તરફાડતા માણુકશાહ શ્રેષ્ઠીના કષ્ટુંપટ પર પ્રભાતનાં ચોધઠીઆંનો અવાજ આવીને અથડાયો.



## પ્રકરણ ૭ મું

૦૫૦૫૦૦૦

### પ્રતિષ્ઠાધ

પ્રભાતનો પ્રકાશ પૃથ્વીના પટ પર પથરાતાં ખણ્ણાં જ  
માણ્યુકશાહ શ્રેષ્ઠી પોતાનાં નિત્યકર્મથી પરવારી રહ્યા. ગાધ  
કાલનાં પોતાનાં બીજાણુ પાપકર્મતું નિવારણ કરવા માટે એમનું  
મન આજે તલબી રહ્યું હતું.

સર્વ સ્વધર્માવલંથી શ્રેષ્ઠીસમુદ્દાયને આમંત્રણ આપી,  
મોટા સમારંભથી શાનોપગરણુલેટણું લઈ માણ્યુકશાહ શેઠ  
સૌ સાથે આચાર્ય શ્રી હેમવિમળસૂરિના આશ્રમે આવી  
પહોંચ્યા.

શ્રી સદગુરુહેવને ભાવસહ લેટણું ધરી, પ્રદક્ષિણું કરી,  
પાંચ અભિગમ સાંચયની, સપ્રેમ ભાવોમિથી વંદના કરીને  
ધર્માપહેશની દેશના આપવા માણેકશાહ શેડે મહારાજશ્રીને  
નમ્ર ભાવે વિનતિ કરી.

પરમ તપઃસિદ્ધ શ્રી આચાર્યદેવે સમસ્થિત ચિત્તથી  
સહુનું મંગળકુશળ વાંછયું અને આરીવીઢાત્મક ધર્મલાભ  
આપ્યો. આચાર્યશ્રીજીનો ધર્માપહેશઃ—

બુદ્ધેः ફલं તત્ત્વવિવારણંચ  
વૈહસ્ય સારો વ્રતધારણંચ ।  
વિત્તસ્ય સારઃ કિલ પાત્રદાનં  
વાચઃ ફલं ગ્રીતિકરં નરાણામ् ॥

તત્ત્વાત્ત્વ, સત્યાસત્ય, ગુણુપગુણુ, હિતાહિત, લાભ-  
લાભ, ભક્ષ્યાભક્ષ્ય, પેયાપેય, ઉચિતાનુચિત વગેરેનો જાન-  
પૂર્વક વિચાર કરીને, સારભૂત તત્ત્વનું અહેણુસેવન કરવું એ જ  
સહાયુદ્ધ પાખ્યાનું કેળ છે. ધર્મનું મૂળ દ્યા છે. અને દ્યાને  
અનુસરીને સર્વ શુલ્ક અનુષ્ઠાન પ્રવતે છે. આ જિન આગમનો  
એક સુખ્ય સિદ્ધાંત છે. તેથી જ સર્વજલાધિત સત્ય ધર્મનું  
બધાર્થ આરાધન કરવાને દ્યાળું હોવાની ખાસ જરૂર છે.  
અથર્તુ દ્યાળું ધર્મરત્નને યોગ્ય છે. દ્યાહીન કોઈ રીતે  
ધર્મને યોગ્ય નથી. કેમકે એવા નિર્દ્દેશ પરિણામવાળાનું સર્વ

અતુધાન નિષ્કળ જાય છે. આ રીતે દ્વા સહિત શ્રી જિનશા-  
સનની પ્રલાવના કરવા તત્પર રહેલું. પવિત્ર જૈન સિદ્ધાંતોનો  
પૂરતો અભ્યાસ કરીને લંઘજનોને ધર્મોપહેશ હેવા વડે,  
હુર્વાદીના મદ ગાળવા વડે, નિમિત્તજ્ઞાન વડે, તપોધળ વડે,  
વિદ્યામંત્ર વડે, અંજન યોગ વડે, અને કાઠયથળ વડે, રાજ-  
પ્રમુખને પ્રતિષ્ઠાધવા અને શ્રી જૈનશાસનની જયપતાકા દર્શ  
દિશે ઝરકાવવા બનતું વીર્ય દ્વારાવલું જોઈએ.

મન, વચ્ચન અને કાયા વડે શુદ્ધ સમક્ષિત ધાળવું;  
મનથી શ્રીજિન અને જૈન માર્ગ વિના સર્વ અસાર છે એમ  
નિરધાર કરવો. શ્રી જિનલક્ષ્મિથી થઈ શકે તે કરવા હુનિ-  
યામાં બીજું કોણું સમર્થ છે? માટે શ્રી જિનહેવ વિના હું  
અન્ય કોઈને પણ પ્રણામ નહિ કરું એવો. મન સાથે નિશ્ચય  
કરવો. જેમ સમક્ષિત શુદ્ધ નિર્મળ થાય તેમ કરલું. શુદ્ધ  
હેવગુરુને યથાવિધિ વંદન કરીને યથાશક્તિ પ્રત પચ્ચાખખાણુ  
કરવાં. ઉત્તમ તીર્થસેવા, હેવગુરુની અક્ષિત પ્રમુખ સુકૃત એવી  
રીતે કરવાં, કે જેથી અન્યદર્શનીજનો પણ તે સુકૃત કર્શોને  
અવશ્ય અતુમોદના કરી યોધી થીજ વાવી, ભવાંતરમાં સુધર્મ  
ક્રણ પામવા સમર્થ થાય. યાવતું મીકાધિકારી થાય.

વીતરાગનાં વચ્ચન પ્રમાણુ કરવાં. સર્વજ્ઞ વીતરાગ પર-  
માત્માએ ત્રણ કાળના જે જે ભાવ ઝણ્ણા તે સર્વ સત્ય છે

એવી દુદ આસ્થાવાળો ઉત્તમ લક્ષ્યણો વડે લક્ષ્યિત સમહિત-  
રતનને ધારી પ્રણુ કાળ જિનદર્શન કરી, પ્રણુકાળ જિનની  
સેવા કરી સુખી થાય છે. અસ્તુ.”

ઉપરોક્ત હેશના શ્રવણુ કરીને માણેકશાહ શેઠ તથા  
સર્વો શ્રોતા શ્રાવકસમુદ્દરો પરમ સુધાપાનની તૃપ્તિ અનુ-  
ભવી, અને નવચૈતન વ્યાપ્તિ સમાન ફરેક હૃદયમાં ધર્મા-  
ધ્યાની અદૈકિક સ્કૃતિ થઈ.

આચાર્યશ્રીનાં જાન, વિદ્ધતા અને વક્તૃત્વશક્તિથી  
ઉજ્જવિનીવાસીઓ વિમુખ બની ગયા. એમની વાણીમાં  
વહેતો શખદસુધારસનો અવિરત પ્રવાહ શ્રોતાજ્ઞનોના અંતરપટ  
ઉપર કાયમને માટે કોતરાઈ જાય એવો સચોટ અને  
અસરકારક હતો. આચાર્યશ્રીના આજના વ્યાખ્યાને સૌને  
૭૫ કરી નાખ્યા.

વ્યાખ્યાન સંપૂર્ણ થતાં જ ઉજ્જવિનીના નગરશેઠ  
માણેકશાહ શ્રેષ્ઠી ઉલ્લય હસ્ત જોડીને જોલા થયા. ગુરુદેવ  
પાસે જઈને તેમનાં ચરણોમાં એમણે પોતાતું ભસ્તક ઝુકાવી  
દીધું. તેમની નસેનસમાં વહેતો પશ્ચાત્તાપનો પ્રવાહ વાણી  
વાટે ખણાર આવવા લાગ્યો.

“ પરમ પૂજય ગુરુદેવ ! ગાંધ કાલે સંધ્યા સમયે જ્યારે  
આપ સહપરિવાર કાઉસગ્ગ દ્યાનમાં બિરાજમાન હતા,

ત્યારે ચો અભાગીએ આપની સાથે એકદમ અયોગ્ય અને  
કૂર વર્તન ચલાવીને આપનો જે અક્ષમ્ય અપરાધ કર્યો છે,  
તે માટે ઉજાયિનીના આ તમામ શ્રાવકસંધ સમક્ષ આજે  
મારા ખરા અંતઃકરણુથી આપના ચરણ્ણોમાં ક્ષમાયાચના  
કરું છું : ”

માણેકશાહની ઉલય આંઝોમાંથી અખ'ડ અશ્રુધારા  
એક સરખા વેગથી વહેવા લાગી. અવાજ ગળગળો થઈ  
ગયો. કંઠ દૂધાઈ ગયો. હૃદયમાં દૂમો લરાઈ આવવાને લીધે  
આથી વધુ એક પણ શરૂદનો ઉચ્ચાર એમનાથી થઈ શક્યો નહિ.

“ ઉજાયિની નગરીના ઓ નિર્મણહૃદયી નરવીર !  
ભૂલ કખૂલ કરવાની તમારી હિંમત, ધર્મપ્રેમ અને ખરા અં-  
તરનો પશ્ચાત્તાપ જોઈને મને અનહુદ આનંદ થાય છે. તમારી  
ગહુકાલની વર્તણુક ગમે તેવી હોય, પરંતુ અમારા મનમાં  
એ વિષે લેશ પણ રોષને સ્થાન નથી. એમ છતાં પણ તમારા  
મનના સમાધાન માટે તમારા કોઈ પણ વર્તન વિષે અમારા  
તરફથી તમને સાચા હૃદયે સંપૂર્ણ ક્ષમા આપવામાં આવે  
છે. ભૂલ એ તો માનવ માત્રનો સ્વાભાવિક ધર્મ છે. પરંતુ  
પોતાની ભૂલને પછી પાડવી, અને તેનો ઝુલ્લા હૃદયે સ્વીકાર  
કરવો, એમાં જ સાચી મહત્ત્વા અને માનવતા છે ! ઓ ન્યા-  
યમાગીં નગરશૈદ ! એક વસ્તુ ખસૂસ યાદ રાખજો ફે આજથી

તમારા શુભકારોનો ઉદ્ય થવા માંડયો છે. એવું મારો અંતરાત્મા મને સૂચ્યવે છે.” આચાર્યશ્રીએ માણેકશાહના અપરાધની માર્ગી આપવા સાથે આશીર્વાનોનો ઉચ્ચાર કરતાં કહ્યું:

“ખૂબ્ય પ્રવર ! મારા અવોર અપરાધને ક્ષમા કરવાની આપની ઉદ્ઘારતાથી હું લવોલવનો આપનો ઝાણી થયો છું. હવે મારી એક જ વિનાંતિ છે”

“ સદ્ગુણી શ્રાવક ! તમારે જે કંઈ કહેવાનું હોય તે સુખેથી કહી હો ! તમારા જેવા ઉચ્ચ ડેટિના આત્માના સમાનગમથી અમને પરમ સંતોષની પ્રાપ્તિ થધ છે.”

“ હ્યાળું હેવ ! મારાં પૂન્ય માતુશ્રીની એવી ઉત્કટ અભિલાષા છે, કે આજે આપશી સહપરિવાર શહેરમાં પધારીને અમારી પૌષ્ઠશાળામાં યતકિંચિતું આહારપાણી તૃફણ કરશો તો આપનો અતિ અનુગ્રહ થશે”

“ અર્સ્તુ, તમારા જેવા ધર્મપ્રેમીને ત્યાં આવવામાં અમને શરી હરકત હોય ? ”

આચાર્યશ્રીએ વિનાંતિનો સ્વીકાર કરવાથી માણેકશાહનું હૈયું હુંદ્યોશથી કૂલી ઊઠયું. એમણે પ્રથમથી જ તમામ જતની તૈયારી કરી રાખેલી હતી. ઉજજયિનીનો શ્રાવકસંધ પણ માણેકશાહશૈક્ષણે ત્યાં જ જમવાનો હતો. એટલે સર્કા

પણ સાથે જ હતો. એટલે કંઈ પણ નવી ગોઠવણુ કરવાની આવશ્યકતા ખાડી રહી ન હતી. માણેકશાહ શેડે ધણુ જ ભંધ સમારંભથી અને અત્યંત આદરસત્કારથી આચાર્ય-શીની પોતાને ત્યાં પદ્ધરામણી કરાવી. ઉજજયિની નગરીમાં જણે એક મોટો ઉત્સવ હોય તેવો હેખાવ થઈ રહ્યો.

માણેકશાહનાં માતુશી કસ્તુરખાને મન તો આજે સોનાનો સૂરજ જિંદો હતો. એમના ત્યાગ અને તપ આજે દ્રળીભૂત થયા હોવાથી એમનાં હૃહયનાં હુઃખુદ્દં આજે આનંદસાગરમાં ફેરવાઈ ગયાં હતાં.

એક જ રાતમાં માણેકશાહનાં લુલનમાં આવો સુંદર પલટો આણ્ણીદેનાર પરમશક્તિશાળી મહાત્માની પદ્ધરામણી થવાથી આખા કુદુંખમાં અપૂર્વ ઉત્સાહ છવાઈ રહ્યો હતો.

આમ પરમપૂજ્ય આચાર્યશીની પરમકૃપાથી એક ધર્મ-પ્રેમી કુદુંખ યુનઃ પરમ આનંદ અને ઉલ્લાસમાં મહા-દવા લાગ્યું



## પ્રકરણ ८ મુ

---

### આગ્રામાં ચાતુર્મસ

સાધુસન્યાસી પાણીના ઐતા સમાન છે એ કહેવત  
જોઈ નથી. પાણીને પ્રવાહ જેમ એક સ્થળે સ્થિર રહેતો  
નથી, તેમ સાધુ પણ કોઈ સ્થાનમાં સ્થિર રહેતા નથી.

પૂજયપાદ આચાર્યશ્રી હેમવિમળસ્ફુરી, માણેકશાહ  
શેડના મનતું સંપૂર્ણ સમાધાન કરીને ઉજ્જ્વિનીમાંથી  
વિહાર કરી ગયા. ચા ઘટના પર કેટલોક સમય વ્યતીત થઇ  
ગયા બાદ એક વખત તેઓ પોતાનાં યતિમંડળ સહિત  
આગ્રા શહેરમાં આવી પહોંચ્યા. આચાર્યશ્રીની પ્રશસ્તિ ચારે

તરફ પુષ્પની સુવાસ પેઠે પ્રસરેલી હોવાથી આથાનિવાસી નરનારીએ એમનાં આગમનથી અત્યંત આનંદિત થયાં. સૌચે મળીને આચાર્યશ્રીને સુંદર સતકાર કર્યો. એમનું વ્યક્તિત્વ જ એવું પ્રભાવશાળી હતું, કે એમની સેવા કરવામાં જ સૈં પોતાનું અહોભાગ્ય માનતાં. એમની વાણીમાં સત્ય અને અહિંસાનું મહાન બળ હોવાથી, એમનો એક જ શખ્ષ અનેક લુચોના લુચનવિકાસ માટે પૂરતો હતો.

ચાતુર્મોસ તરત જ શરૂ થવાનો સમય હોવાથી આથાની ભાવિક જનતાએ આચાર્યશ્રીને આથામાં જ ચાતુર્મોસ કરવાનો અત્યંત આથહ કર્યો. આ દોકોની અતિ ભાવ-ભરી વિનંતિનો અનાદર થઈ શકે એમ ન હતું. આથી આચાર્યશ્રીએ ચાતુર્મોસ આથામાં જ કરવાનો નિર્ણય કર્યો.

આચાર્યશ્રીના આ અતુથહથી આથાનાં શ્રાવકશ્રાવિકાએના અને અન્યવગ્નના આનંદનો પાર રહ્યો નહિ. આથામાં જ્ઞાન કોઈ મોટો ઉત્સવ હોય તેમ દોકોનાં ટોળેટોળાં આચાર્યશ્રીનો સહૃપદેશ શ્રવણ કરવાને ઉભરાવા લાગ્યાં.

આ ઐતિહાસિક કથાના સમયમાં આપણ્ણા દેશની વ્યાપારી પરિસ્થિતિ આજના નવા ધોરણું પર રચાયલી ન હતી. કારણું કે પૂર્વકાળમાં આજનાં સાધન સગવડેનો સફાતર અલાવ હતો. વ્યાપારી દોકો પોતાના ગ્રદેશમાં

ઉત્પન્ન થતી વસ્તુએ અન્ય પ્રહેણોમાં લઈ જતા, અને અન્ય પ્રહેણોમાં પેઢા થતી ચીને પોતાના દેશમાં લઈ આવતા. આવા પ્રકારના વ્યાપાર વ્યવહારમાં એમને લાંધી લાંધી મુસાક્ષરીએ કરવી પડતી, તેમજ પાર વગરની તક-લીછે અને હાડમારીએ સહન કરવી પડતી. આમ જુદા જુદા પ્રહેણોના જુદા જુદા પ્રકારના ચલણી નાણુંડ્રખ દ્રવ્યો જેવાં કે કેસર, કસ્તુરી, કરિયાણું, સોતું, ચાંદી, હિરા, મોતી આદિના કુચ વિકુચ અને સંચયથી દેશની સંપત્તિ, સુખ સમૃદ્ધિ અને આખાદીમાં દિનપતિદિન વૃદ્ધિ થતી રહેતી.

ઉજ્જવિની નગરીના નગરશૈઠ માણુકશાહ શ્રેષ્ઠી પોતાના પૂર્વને પગલે વંશપરંપરાથી એ જ વ્યાપાર એડતા. વ્યાપાર અથે દૂરદૂરના દેશોનો દરિયો એડતાં પણ તે કદ્દી અચકાતા નહિ. જુદા જુદા સમય અને મોસમની અનુકૂળતાએ તે વિધવિધ વસ્તુએ સાથે દેશ વિદેશમાં આવન કરતા.

જે અરસામાં આચાર્યશ્રી હેમવિમળસૂરિએ આચાર્મા ચાતુર્માસ ગાળવાનો નિર્ણય કર્યો, એ જ અરસામાં માણુકશાહ શૈઠ પણ વ્યાપાર અથે કરતા કરતા અનાયાસે આચાર્મા આવી ચડયા. અહીં તો એ વખતે જણે કોઈ મોટો ઉત્સવ હોય એવી તૈયારીએ ચાલી રહી હતી. તપાસ કરતાં જણાયું કે જે શુરૂદેવે એમને અવળે માર્ગેથી ઉતારીને ધર્મનો સાચો રાહ બતાઓયો હતો, તે જ આચાર્યશ્રી હેમવિમળસૂરિના

આથાના ચાતુર્માસને લીધે જ આ તમામ પ્રવૃત્તિઓ યોજવામાં આવેલી હતી.

આ સમાચાર સંભળતાં જ માણેકશાહ શેડનું અંતર હૃષીવેશથી નાચી ઉઠયું. આજે કેટલાએ લાંખા સમય બાદ એ જ પરમપૂજય ગુરુહેવનાં દર્શન થશે એ આશાએ એમનું હૃદય પુલકિત બની ઉઠયું. જરા પણ સમય ન ગુમાવતાં તે જ વખતે માણેકશાહ શેડ શ્રી સદ્ગુરુ ચરણુમાં ઉપસ્થિત થયા. ગુરુહેવને ગ્રહક્ષિણ્ણ વંદનાદિ કરીને માણેકશાહે યોજ્ય આસન લીધું. માણેકશાહના આજના એકાએક આગમનથી આચાર્ય શ્રી પણ અતિ સંતુષ્ટ થયા. એમણે શ્રાવકના ભૂળ ખારપત અધિકાર સંભળાવ્યો, અને માણેકશાહે ખારપત ઉચ્ચાં પછી શ્રી ગુરુહેવના આદેશથી પોતાની સાથેની માતરની તમામ પોતાને બીજે જ દિવસે પાછી ઉજજયિની તરફ રવાના કરી દીધી. પોતે શ્રી સદ્ગુરુચરણુમાં ચાતુર્માસ ગાળવાનો નિશ્ચય કરીને ત્યાં જ રોકાઈ રહ્યા. ગુરુહેવનાં દર્શન માત્રથી જ એમની બ્યાપારી અને બ્યવહારી વૃત્તિ, ત્યાગ અને વૈરાગ્યની વાડે વળી ચૂકી.

માણેકશાહ શેડે શ્રી સદ્ગુરુનાં સામીખ્યમાં હિનપ્રતિ-દિન સામાચિક એ વખત, પ્રતિકમણુ, પોષહ વગેરે ધર્મ-કરણી ઉથ અને એકાચ્છાયા કરવા માંડી. બ્યાખ્યાનમા વાંચવા ગુરુહેવે શરૂ કરેલું શ્રી સિદ્ધાચળ માહાત્મ્ય પણ એમણે પરમ

શ્રદ્ધાપૂર્વક અવણુ કર્યું. આ માહાત્મ્ય લાખિક જીવને એકાવતારી કરીને મોક્ષપદની પ્રાપ્તિ કરાવે એવી અનંત શક્તિને ધરાવનાર છે એ વાત માણેકશાહની રજેરગમાં ઉત્તરી ગઢ.

ઉચ્ચ કોઈના સંસારી જીવો પણ એક તરફ ઉદ્ધમ, કાર્ય, વ્યાપાર, વ્યવહારથી અને બીજુ તરફ દ્વાય, ન્યાય, નીતિયુક્ત સત્યધર્મ વિચારથી વેરાઈ જઈને સત્ય માર્ગને શોધતાં ધર્માચાર ગુંચવાઈ જાય છે. આ ઉલ્લય બાળુઓના સુમેળને સાધવાતું વિધાન જાણુનાર જીવ તો દેવકોટિનો જ ગણ્યાય છે. આવા વિરલ જીવોતું લવાંતરે ઉદ્ગમસ્થાન દેવશ્રેણીમાં થતું જાય છે.

માણેકશાહ શેડ આવા દેવકોટિના જીવ હોવાથી એમનો આત્મા દિનમતિદિન વિકાસના પણે પ્રગતિ કરી રહ્યો હતો.

સંસારના આધિ, વ્યાધિ અને ઉપાધિમય ત્રિવિધ તાપમાં તવાચેલાં માણેકશાહ શેઠનાં પવિત્ર અંતરમાં શ્રી સદગુરુની શીતળ છાંયાથી અને શ્રી સિદ્ધાચળ જિનહેવ-ભૂમિના માહાત્મ્યનાં અમૃતસિંચનથી શ્રી જિન આગમ શ્રવણથી પ્રભુનાં દર્શનવંદનની અતિ ઉત્કંઠા જાગી જાઈ. પૂર્વ-જન્મના અનેક પ્રથળ શુલ સંસ્કારોનો એકાએક ઉદ્ય થવા માંડયો.

માણેકશાહ શેડે શ્રી શુરુદેવ સમક્ષ ઉપસ્થિત થઈને  
પોતાની એ અભિલાષા અતિ વિનાન લાવે વ્યક્ત કરી.

“ પરમ પૂજ્ય શુરુવર ! મારે અન્ન જળનો ત્યાગ કરી  
પગપાળા ચાલીટાઠ, તાપ આદિથી શરીરને જે કંઈ ઉપ-  
સર્ગ થાય તે તમામ સહન કરીને શ્રી સિદ્ધાચળની યાત્રા  
કરવાનો અભિથહ ધારણુ કરવો છે. માટે મારો આ અલિ-  
થહ નિર્વિદ્ધે પાર પડે એવો આપ અતુથહ કરીને મને  
આશીર્વાદ આપો. ”

માણેકશાહના આ શાખો શ્રવણ કરીને આચાર્યદેવના  
આશ્ર્યનો પાર રહ્યો નહિ. માણેકશાહ શેડનું ઘીલતાં કુસુમ  
સરખું કેમળ શરીર આવી અતિ કપરી કસોટીમાંથી પાર  
જિતરી શકશે કે કેમ એ શાંકાએ શુરુદેવનું મન ચિંતાઓસ્ત  
બની ગયું. આવો જેખમી અભિથહ ધારણુ ન કરવા એમણે  
માણેકશાહ શેડને અનેક રીતે સમજાવવા માંડયું.

આશાથી છેક સિદ્ધગિરિ સુધીનું અત્યંત લાંખુ અંતર,  
લાંખા સમયનો પ્રવાસ, માર્ગની વિકટતા, નંદી, નાળાં તેમ જ  
આડ, પહાડ અને જંગલોમાં પગપાળા ચાલતાં વાધ, સિંહાદિ  
હિંસકપશુઓનો લય, તેમ જ અન્ન, જળ ત્યાગના મહા ઉપ-  
સર્ગને લીધે શરીરમાં આવતી અનહદ શિથિલતામાંથી પ્રાણ-  
રક્ષા કરવાની અનિવાર્ય આપત્તિનું બહુ જ સૂચકલાખથી

સમર્થન કર્યું. પરંતુ ભાવિના કોઈ અકળ લેદથી માણુકશાહ શેડનું ધર્મપ્રેમી હૃદય અભિગ્રહ ધારણ કરવાના પોતાના નિશ્ચયમાં મેરુ સમાન મજૂમ રહ્યું. એમનો અડગ નિશ્ચય કોઈ પણ રીતે મિથ્યા નહિ થઈ શકે એવું જેવામાં આવતાં આચાર્યશ્રીએ મને અંતઃકરણપૂર્વક આશીર્વાદ આપ્યા.

માણુકશાહ શેડે ખરાખર કાતિંક ભાસની કૃષ્ણ પ્રતિ-પદાના હિને પ્રાતઃકાળમાં આથાથી શ્રી સિદ્ધગિરિ પ્રત્યે પ્રયાણ આદયું. ખરાખર, ભાવિના લેદ ઉકેલવા કોણું સમર્થ છે ?



## પ્રકરણ નવમું

મંત્રસાધના

ઉજાજયિની નગરીની કિશ્ચા નહી પરનું ગંધવીં  
સમશાન દિવસના સમયમાં તો બીજા હરકોઈ સમશાન જેટલું  
જ લયંકર હતું. પરંતુ રાત્રિના સમયે એ એટલું તો લયંકર  
બની જતું કે, ભાગ્યે જ ત્યાં જવાની કોઈ હામ બીડે !  
એ વખતે તો નહી, લેખડો અને આડનાં ફૂંડાં પણ જણે  
ભૂતનો આકાર ધારણું કરી વેતાં.

અને આજે તો કાળીચૈદશની કાળી રાત એટલે ગંધવીં સ્મરણાની ઘાર લયાનકતામાં પૂછવું જ શું ! આજની કાળીરાત્રિની તમામ કાળાશ બાણે ઉજ્જવિની નગરીના ગંધવીં સ્મરણમાં આવીને એકઠી થઈ હતી. હૃદયને લેદી નાંખે એવા લયાનક ચિત્કારોથી સમસ્ત સ્મરણમાં છંડુક અજ્ઞાન લયાનકતા ભરાઈ રહી હતી.

લોકમાન્યતા સુજ્ય ગંધવીં સ્મરણાની કાળી ચૈદશની રાત્રિ અન્ય રાત્રિઓ કરતાં અનેક ગણી ગંભીર ગણ્યતાની. વાતો ચાલતી કે એ રાતે ચોસઠ જેગણીઓ અહીં રાસ રમવા આવતી. બાવન વીર અહીં વૈતાળોની સંગે નૃત્ય કરવા આવતા. માથા વિનાના ખવીસો આ સ્મરણમાં આજે નિરકુંશ મહાલતા. મહાકાલી પોતાના ખપપર માટે ખોપરી-ઓની શોધમાં રહડતી. ભૂત, પ્રેત, ચુડેલ, ડાકિની, શાકિની આહિ પ્રેત યોનિનો આજે એક મહાન મેળો હતો. મેલી વિદ્યા તેમ જ મંત્ર સાધના સાધતા સાધકો, અને હાઉકાંઓને શોધતા કાપાલિકો સિવાય આજની રાત્રે લાગ્યેજ કોઈ નજરે ચડતું. ડેકઠેકણે લડલડ થતા લડકાઓ લાળીને પથર હૃદયનો માણુસ પણ લડકીને લાળી જય એવી અજ્ઞાન-ગજાની લયાનકતા આજે ઉજ્જવિનીના ગંધવીં સ્મરણમાં લારોભાર ઉભરાઈ જતી હતી.

સમય બરાબર મધ્યરાત્રિનો હતો. કાળી ચૈદશની

કાળી સમસમાકાર રાત સમશાનની શૂન્યતામાં પોતાના હૃદયલેદક સૂસવાટા લરતી વહી જતી હતી. વર્ચ્યે વર્ચ્યે કોઈ કૂતરાના રોફન કે શિથાળના અવાજ સિવાય આ સમશાની શાન્તિમાં ભંગ પાડનાર કોઈ ન હતું.

આ વખતે કાળા ઓળા જેવી એક વ્યક્તિ આ લયંકર સમશાનની અધોાર લયાનકતા વર્ચ્યે કંઈક મંત્રસાધના સાધવામાં મશગૂલ હતી. એની ડાકે ઓખી ઓપરીઓની એક બિહામણી માળા લટકતી હતી. એ ઓપરીઓનાં લયંકર નિર્ણય જડણાં મૃત્યુહાસ્ય હસી રહ્યા હોય એમ એ ઓપરીઓની વર્ચ્યે દાંત હેખાતા હતા.

આ સાધક વ્યક્તિએ પોતાની આસપાસ પોતાનાં રક્ષણ માટે તલવાર વડે એક ગોળ કુંડળું હોરેલું હતું. ઉપરાંત એની આજુથાજુ ચારે દિશાએ ચાર ખુલ્લી તલવારે નજીકમાં જ જમીનની અંદર થોડી થોડી દાઠીને જિલ્લી કરવામાં આવી હતી. એણે મેલી સાધના માટે ઉપયોગી થાય એવા કેટલાક અભક્ષય અને અપેય પહાર્થી પોતાની ચારે આજુએ ગોઠવી રાખેલા હતા. વારંવાર તેનાં રહેંબાંથી કંઈક મંત્રાચ્ચારના ઝીણુા શાખ્દો અહાર આવતા અને અહારની લયાનક શૂન્યતામાં લળી જતા.

આવી કાળી અધારી રાતે ઉજજયિનીના ગંધવીં સમશાનમાં આ કોણુ હશે એવો પ્રશ્ન કોઈને પણ ઉપસ્થિત થાય

એમાં નવાઈ નહિ. એ ભાષુસ પેલા જૈન યતિ પદ્મનાભસૂરિનો મીઠલાવેલ એક કાપાલિક હતો. કાળા ગોરા લૈરવને વશ કરવા માટે તે કાળી ચૈદશની રાતે આ ગંધવીં સમશાનમાં આવ્યો હતો. હરકોઈ મોટી સાધના સાધવા માટે મહાન સાધકોને કાળી ચૈદશની રાતે હર દ્વારથી છેક ગંધવીં સમશાનમાં આવવું પડતું. આ કારણથી એ કાપાલિક પણ આજે અહીં પોતાની મેલી સાધના સાધી રહ્યો હતો. છેક સવાર પડતાં લગી જુદી જુદી કિયાઓ કરતા રહીને એણે પોતાનો મેલો પ્રયોગ સિદ્ધ કરી લીધો.

દ્વાંકાગચ્છના જૈન યતિ પદ્મનાભસૂરિ વાગ્યકની જાણ અહાર નહિ હોય. જેણે એક વખત માણ્ણુકશાહ શેઠનું મન દેવહેરાસરનાં પૂજનઅર્યનમાંથી ફેરવી નાખ્યું હતું તે જ એ પદ્મનાભસૂરિ.

માણ્ણુકશાહ જેવા પ્રતિષ્ઠિત નગરશેઠને પોતાના મત તરફ ફેરવી નાખવા માટે તે મગજર હતો. એક માણ્ણુકશાહ ધીના હંજરાને ફેરવી શકશે એવી આશા એ સેવી રહ્યો હતો. પરંતુ આચાર્યશ્રી હેમવિમળસૂરિની અદભુત શક્તિએ એ તમામ આશાઓ પર એક જ અપાટે પાણી ફેરવી દીધું હતું. પોતાની સધળી જહેમત આમ એકાએક ધૂળધાણી કરી નાંખનાર આચાર્ય શ્રી હેમવિમળસૂરિ ઉપર તે ઊરી નાગ જેવા ફોધાયમાન બની ગયો હતો, કોઈ પણ રીતે આ

વેરનો અદલો લેવા તે તલખી રહ્યો હતો. આ કારણુથી કાળાગોરા લૈરવને વશ કરવા માટે તેણે મેલી સાધનાના પ્રયોગ અજમાવવા માંડ્યા હતા. અને કાળી ચૈદશની રાતે એ મેલી સાધનાના એક સાધકને ઉજજયિની નગરીના ગંધવીં સમશાનમાં મોકલાવીને એણે પોતાના એ પ્રયોગને પરિપૂર્ણપણે સાધી લીધો હતો.

પ્રયોગ સિદ્ધ થતાં હવે તેણે એ પ્રયોગ આચાર્ય શ્રી હેમવિમળસૂરિના પરિવાર પર અજમાવવા માંડ્યો હતો. કાળાગોરા લૈરવ મંત્રસાધના વડે વશ થઈ જવાથી હવે તેઓ એની આજા ઉઠાવવા અડે પગે તૈયાર હતા. અને એની આજાથી જ તેઓ દરરોજ આચાર્ય શ્રી હેમવિમળસૂરિના પરિવારના એક સાધુના શરીરમાં પ્રવેશ કરતા. સાધુના શરીરમાં પ્રેત યોનિનો પ્રવેશ થતાં જ તે આખે દિવસ ચારે તરફ ધૂમવા મંડી જતો. આમ નિર્દ્દ્ય રીતે ધૂમાવી ધૂમાવીને કાળાગોરા લૈરવ થીજે દિવસે આ નિર્દ્દ્ય સાધુના શરીરનો અંત આણુતા. આમ દરરોજ એકેક સાધુનું અતિ કરૃષુ રીતે મૃત્યુ થવા લાગ્યું.

આચાર્ય શ્રી હેમવિમળસૂરિને માટે પોતાના પરિવારની આ યાતના એકદમ અસહ્ય થઈ પડી. એક રીતે વિચારતાં મૃત્યુ તો મોડું વહેલું હરેક પ્રાણી પર નિર્માણ થએલું જ છે, પરંતુ દરરોજ એકેક સાધુનો આવી લયાનક રીતે અંત

આવતો એમનાથી જોઈ શકતો ન હતો. સાધુઓના આ લેટી અને ભયંકર મૃત્યુ માટે એક પણ ઈલાજ કે એક પણ દવા કારગત નીવડયાં નહિ. મૃત્યુના આ ઘોડાપૂરને રોકવાનું સર્વથા અશક્ય થઈ પડયું; તેમ તેને લેટ પણ કોઈ જાણી શકયું નહિ.

આખરે આચાર્ય શ્રી હેમવિમળસૂરિએ જ્ઞાન નિમિત્તથી વિચાર કરીને આ ઉપદ્રવ ટાળવા માટે શાસનહેઠીનું આરાધન કર્યું; અને એ વખતે એમને પ્રત્યુત્તર ભજ્યો, કે “તમે વિહાર કરતા કરતા જ્યારે ગુજરાત તરફ જશો, ત્યારે તમને એ ઉપદ્રવ ટાળનાર ટેવનો પ્રત્યક્ષ પરચો થશો.”

આ પ્રત્યુત્તરથી આચાર્ય શ્રી હેમવિમળસૂરિના મનનું ધણે અશો સમાધાન થયું. પરંતુ પોતાના પરિવારના દશ સાધુઓનો જ્યાં નિર્દ્દ્ય રીતે ધાત કરવામાં આવ્યો હતો, એવું આચા શહેર હુવે સુરિણે જાણે ખાવા ધાતું હોય એવું લાગવા માંદયું.

આચાની તમામ જનતા પણ આ ભયંકર ધટનાથી અત્યાંત ઉચ્ચાટમાં પડી ગઈ હતી. આચાર્યશ્રીના અંતર પર લાગેલી ચોટ જેટલી જ આચાવાસીઓના હૃદય પર પણ લાગી હતી. આચાનાં ભાવિક શ્રાવક શ્રાવિકાઓ પોતાના પરમપૂજ્ય શુરૂહેવની આવી હુખુ દરા. જોઈને ભાવરાં

ખની ગયાં હતાં. શેરી, ચીટે અને ગલીએ ગલીએ આ એક જ વાત ચર્ચોઈ રહી હતી. પરંતુ આ હુઃખદાયક દર્દનું ઔષધ કુયાંથી પણ અસ્તિત્વ ધરાવતું ન હતું.

આતુમોસ સંપૂર્ણ થતાં જ આ તરફ માણુકશાહ શ્રેષ્ઠીએ પોતાની લીધણું પ્રતિજ્ઞા સાથે શ્રી સિદ્ધગિરિ પ્રત્યે પ્રયાણ કર્યું અને ખીલુ તરફ આચાર્ય શ્રી હેમવિમળસૂરિએ પોતાના દસ દસ શિષ્યોના હુઃખ અને દાસણું અવસાનતું દર્દ હૃદયમાં લઈને, અને અગિઆરમા શિષ્યને ભરણું પથારી પર મૂકીને ખિલ હૃદયે શ્રી શાસનહેવીની આજા અનુસાર ગુજરાતને માર્ગ વિહાર શરૂ કર્યો.



## પ્રક્રણ ૧૦ મુ

---

### આત્મ ખલિદાન

સ્ટુભસ્ત જગતને પોતાના પ્રચંડ તાપથી તપાવતા અવિતા હેવ અસ્તાચણે સીધાવવાની તૈયારીમાં હતા. સંદ્યા-હેવી બાસ્કર લગવાનને વધાવવા માટે કુમકુમનો થાળ કાઢને ધીમે પગલે ચાદી આવતી હતી. વિશાળ વન તરુ-વરેના અતિ લાંબા ગંભેરા ઓળા હળવે હળવે અદૃશ્ય થવા લાગ્યા હતા. ઝોરાકની શોધમાં જંગલે જંગલ જિડનારાં પંખીઓ પોતાના માળામાં પાછાં કુરવા માટે તર્પર બની

રહ્યાં હતાં. ખાલપખીડાં પોતાનાં માતાપિતાની અતિ ઉત્સુક અંતરે રાહ જોતાં ‘ચીં ચીં’ અવાજે જંગલનાં આડો ગજવી રહ્યાં હતાં. દિવસભરનો જંગલનો કોલાહલ શનૈઃ શનૈઃ શાન્ત પડતો જતો હતો. સંધ્યાની રમણીયતાનું જંગલની રમણીયતા સાથે સંભિશ્રણ થતાં નિસર્જનું સૌનંદર્ય કંઈ અનેરી છટાથી ખીલી જાડયું હતું.

આ સમયે એક અવધૂત યોગી જેવો લાગતો મસ્ત માનવી આ ઘનઘોર જંગલની અંદર વાયુવેગે વિચરી રહ્યો હતો. નથી એને ભૂખરું ભાન કે નથી એને પ્રાસની પિછાન. ભૂખ અને તરસ જાણે એનાથી સહાને માટે ફર થઈ ગયાં હતાં. આ ઘટાટોએ જંગલ અદ્ય સમયમાં જ રત્નિના કાળા અંધકારથી વ્યાપ્ત બની જશે એ વાત એના લક્ષમાં જિતરી હોય એમ લાગતું ન હતું. વિકરાળ વાધ, વરુ વગેરે હિંસક પ્રાણીઓ એના ફુર્ઝણ અનેલા હેઠને પલવારમાં જ ઝડી ખાશો એવો એને સ્વર્ણે પણ ભાસ ન હતો. એને એનું પોતાનું પણ ભાન હતું કે કેમ એ વસ્તુનો નિર્ણય કરવાનું કામ પણ મુરકેલ હતું.

આ માણુસ કોઈ મહા અધ્યાત્મમવાદી મહાપુરુષ છે, કે જંગલી ગમાર છે એ પણ ઉપલક દૃષ્ટિએ લેનાર જાણી શકે એમ ન હતું. એ ઉહાપણુનો ભંડાર છે કે દિવાનાનો સર-

હાર છે એ કણી શાકવું કહિન હતું. એ સદ્ગુહસ્થ છે કે ચોાર છે, કે ડાકુ છે તેનો કશો જ નિર્ણય થઈ શકે નહિ એવા એના ૨ંગ ૬ંગ, જેનારને ઘડીભર મૂંઝવણુમાં ગરકાવ કરી દેવાને પૂરતા હતા. ખાડા, ટેકરા, પીણો, જંગલો, સૌ એને મન સમાન હતું. આત્મભદ્યાનમાં જ ધ્યાનમસ્ત ઘનેલો આ ધૂની જેવો જણુંતો માનવી એક સરખી ગતિએ જંગલનો માર્ગ કાપી રહ્યો હતો. એતું લક્ષ્યઅન્દું શું છે તે કોઈ પણ માણુસની કદ્વપનામાં જીતરી શકે એવો વિષય ન હતો.

વાચક ! આ વનવિહારી વ્યક્તિને હવે કદાચ એળખી શક્યા હશો. એ અન્ય કોઈ નહિ, પરંતુ ઉજાયિની નગરીનો નગર શેડ માણેકશાહ શ્રેષ્ઠી પોતે જ હતો. શ્રી સિદ્ધાચળનાં દર્શન થતાં સુધી અન્નજળનો ત્યાગ કરવાની એની ભીષણું પ્રતિજ્ઞાએ એના આત્માની અંદર અજ્ઞાન શ્રદ્ધાતું સિંચન કર્યું હતું. અને એ અભૂત શ્રદ્ધા જ એને છેક આચારી અહીં ડિસા અને પાલણુપર પ્રદેશના મગરવાડા ગામના ગાડ જંગલો સુધી જેંચી લાવી હતી. શ્રદ્ધા એ એક એવી અજ્ઞાન શક્તિ છે, કે જેની પાસે બુદ્ધિનાં તમામ હૃથિયાર હેઠાં પડી જાય છે. શ્રદ્ધાના સાનિધ્યમાં બુદ્ધિ બહેર મારી જાય છે, મહાત-નિરાધાર અની જાય છે. જ્યાં બુદ્ધિ પોતાની પાંખો ફેરફારતી એસી જાય છે, ત્યાં શ્રદ્ધા પોતાતું ધાર્યું નિશાન સર કરી જાય છે,

શ્રદ્ધાની આવી મહાશક્તિને પોતાના હૃદયમાં ડાંસી ડાંસીને ભરનાર માણેકશાહ શોઠ આજે આ ભયાનક જંગલમાં આવી પહોંચ્યા હતા. શ્રી સિદ્ધગિરિના અવિરત રટન વચ્ચે તે આ અધોર જંગલના માર્ગને તીરના વેળે વીંધી રહ્યા હતા. પરંતુ લાવિના ગર્ભમાં શું છુપાયેલું છે તે કોણ જણી શકયું છે! લાવિના લેદ કોણ ઉકેલે!

જગતમાં મહાપુરુષોનું જીવનપરિવર્તન અચાનક અને અદ્ભુત રીતે થાય છે. કુદરત ને વ્યક્તિનો જીવનપલટો કરવા ધારે છે, તેને જણે હાથ પડકીને જ નવે રસ્તે ચઢાવી હે છે. ધર્તિહાસના પટ પર આવાં અનેક ઉદ્ઘારણો મોજૂદ હે.

ઉજજયિની નગરીના માણેકશાહ શ્રેષ્ઠિનું જીવનપરિવર્તન પણ આવા જ કોઈ અનેરા સંલેખાને આલારી હતું. કારણ કે :-

ક્યાં ઉજજન કયાં આગરા, ક્યાં સિદ્ધગિરિખર સ્થાન!

ક્યાં માનવ માણેકશાહ, ક્યાં મણિબદ્ર મહાન!

મહાપુરુષોના જીવન પલટા સમયે કુદરત વેરાઈ ગયેલા મણુકાને એકઠા કરીને તેની માળા કોઈ અકળ કળા વડે પોતાના હાથે જ પરોવી હે છે.

માણેકશાહ શોઠનું જીવનપરિવર્તન પણ આવા અનેરા સંલેખાના અણુધાર્યો ઔક્યશી થવા પામ્યું હતું. એક શ્રી

સિદ્ધગિરિના આત્મધ્યાન સિવાય એમને ખાલી જગતનું બિલકુલ ભાન ન હતું. રાત દિવસ સિદ્ધાચળ સમરણું એમના અંતર પટ પર રમી રહ્યું હતું. એમનાં હૃદયના પ્રત્યેક ધર્મકારમાં સિદ્ધગિરિ શખફ ધડકી રહ્યો હતો. એમની રક્તવાહિનીઓમાંનું રક્ત સિદ્ધગિરિ સમરણે વહી રહ્યું હતું. એમનાં અંગેઅંગ, અણુઅણુ અને રૈમેરોમ શ્રી સિદ્ધ ગિરિના મહામંત્રનો અખંડ ઉચ્ચાર ઉચ્ચરી રહ્યાં હતાં. જે મહાપુરુષનાં જ્ઞાન અને યુદ્ધ આવી ઉચ્ચતમ ભૂમિકામાં વિચારી રહ્યાં હોય, તે હેઠ જેવી એક તુચ્છ વસ્તુની દરકાર પણું કેમ કરે! હેઠ તો એમને મન એક પરપોઠો જ હોય. એ રહે તોય શું, અને જ્યાં તોય શું!

જે જંગલમાં આજે માણેકશાહ શોઠ એક રણુશ્વરા રણ્ણવીરની માઝુક જાણુભી રહ્યા હતાં એ જંગલ ચોર, ડાંકુ અને લૂંટારાઓનું સુખ્ય ધામ હતું. આ લોકોનું એક મંડળ આજ સવારથી જ કોઈ શિકારની શોધમાં આ જંગલમાં ભટકી રહ્યું હતું. પરંતુ કમનલીએ આજે આખા દિવસમાં કોઈ માલહાર શિકાર એમના હુાથમાં જડપાયો ન હતો. આથી આજે તેઓ નિરાશ અની ગયા હતા. સાંજ પડતાં હું એ બધા અહીંથી ઉપરી જવાની તૈયારી કરી રહ્યા હતા.

એટલામાં જંગલ અને જાડીમાંથી પવનવેળી ગતિએ

પૂર્વપાટ ચાહ્યા આવતા માણેકશાહ શેડ પર એમની દૃષ્ટિ પડી. “ કર્મ છુપે ન લભૂત લગાયો. ” એ સૂત્રાતુસાર માણેકશાહ શેઠનાં વ્યક્તિત્વની તેજસ્વિતા આજની અવ્યવસ્થિત સ્થિતિમાં પણ એમના ચહેરા પર ચમકી રહી હતી. કમળપુષ્પ સમાન એમની સુકોમળ સુખમુદ્રા મહાન શ્રીમંતીને પણ હુલ્લાંલ હતી. એમનાં અંગેઅંગમાં ખાનહાનીનું ઓજસ ઉલરાઈ રહ્યું હતું.

આવા શ્રીમંત જણુતા શાહ પુરુષને આ અદોર જગલમાં એકદો આવી ચાલેલો જોઈને, ચોર મંડળની નિરાશામાં આશાનો સંચાર થયો. જડપી ગતિએ અપાટાખાંધ પસાર થઈ જતા આ મહાપુરુષને એમણે તરત જ જિલા રહેવાને પડકાર કર્યો. પરંતુ અહીં માણેકશાહ શેડ કયાં હતો, જે એમના પડકારની પરવા કરે ! આ તો એક મહા અવધૂત ચોરીચાજ પોતાનાં આત્મધ્યાનમાં જ મસ્ત હતો. એના બહારના કાન બંધ થઈ ગયા હતા. ચોરીના પડકારને શ્રવણું કરી શકે એવી એમની સ્થિતિ રહી ન હતી. ચોરીનો પડકાર એ બહેરા કાનો પર અથડાઈ પાણો કર્યો. એમની ગતિ જેમની તેમ એક સરખા વેગથી ચાલુ હતી.

માણેકશાહ શેઠની આવી વિલક્ષણુતા જોઈને ચોરીના અંતરમાં શંકાનો ઉદ્ભલવ થયો. આવો શ્રીમંત જણુતો

માણુસ આઈલો ગમાર હોઈ શકે અરે ? ચારે વિચારમાં પડ્યા. એમના પડકારની દરકાર ન કરે એવી એક પણ વ્યક્તિત આજ લગી એમની નજરે ચરી ન હતી. એમણે વિચારું કે આ શ્રીમંત માણુસ લુંટારાના ભયથી જ હિવાના પણુનો ખાડ લજવી રહ્યો છે.

માણુકશાહની મસ્ત દશાને એક ઢાંગ માની લઇને આ લોકો એકદમ કોધાયમાન બની ગયા. આખા હિવસની શિકારની તલાપ હવે કોધની પરાકાષ્ઠાએ આવી પહોંચી. એમણે પોતાનાં તમામ હથિયારો સાથે માણુકશાહનાં શરીર પર એક સામઠો ધસારો કર્યો.

આ મહાપુરુષના મહાન આત્માએ એના હેઠ સાથેનો સંખ્યાતો કયારનોએ તળુ દીધો હતો. પરંતુ સ્થૂલ દષ્ટિએ હેખાતો સંખ્યા પણ આ દ્યાહીન ડાકુએએ અનેક ભયંકર જીજોથી ઝર કરી દીધો. કોધાવેશમાં એમણે માણુકશાહ શેઠનાં શરીરના તણ દુકડા કરી નાંખ્યા. ઉજાયિનીના નગર શેઠનો અમર આત્મા એમના હેહકૃપી ધરને લેદીને અનંતજ્યોતિમાં એકાકાર થઈ ગયો. અંત સમય સુધી એમના હૃદયમંહિરમાં શ્રી સિદ્ધગિરિના રટનનો ધ્વનિ અખંડ અને અખંગ રહ્યો.

**ધ્રુમ્દ્યાનમાં તરણોળ બની રહેલા આત્માની અંદર**

વેર, વિરાધ, શોક, હુઃઅ કે ભયને માટે સ્થાન હોતું નથી. એ તો ઈષ્ટસિદ્ધિનાં પોતાનાં લક્ષ્યબિનહુમાં જ લીન હોય છે, તર્ફુપ હોય છે. માણેકશાહ શેડની વિલૂપુળ ઉત્તમાદદશા પણ આવી જ તર્ફુપતાના પ્રતીક રૂપ હતી. શ્રી જિનશાસન ધર્મધીર જીજ વીરગતિમાં વિરામ્યો. હેઠ દર્શી પડ્યો અને આત્મા પરમાત્માની પરમ વિલૂપુત્રૂપ હેવકેટિમાં પ્રવેશ પાડ્યો.

મહામૂલી માલવલુભીની ઉજજયિની નગરીના નગર-શેઠ માણેકશાહ શ્રેષ્ઠનો પવિત્ર આત્મા ચા અદ્ભુત આત્મ-ભલિદાનથી ભુવનપતિ હેવોમાં બ્યંતર માણિબદ્રના નામે મશદૂર થયો.

આજ પણ માણિબદ્ર વીરનાં વણું સ્થાનક પૂજાય છે. ઉજજયિની નગરીની કિંપા નદીને તટે વિશાળ વટવૃક્ષ નીચે મસ્તક પૂજાય છે, મગરવાડામાં દીંચણું પૂજાય છે, અને ઉત્તર ગુજરાતમાં વીજપુર નજીબીક આગલોડ ગામે ધડ પૂજાય છે.\*

\* વિકલ સંવત ૧૭૩૩ ની સાલમાં તપગંગ વારી આચાર્ય શ્રી શાન્તિસોમભુર્દિએ આગલોડ ગામે માણિબદ્ર વીરનાં ધડ પૂજનનાં સ્થાને એકસોએકવીસ ઉપવાસ કરી, પદ્માસને બેસિને આરાધન કર્યું હતું. આ વખતે માણિબદ્રનિર પ્રગટ થયા, અને એમને આખ મીચાને ફરી ઉધારવાની આગા કરી. આચાર્ય આખ મીચાને

ધન્ય હો ! અખૂટ શ્રદ્ધાના અંખાર ઝૂપ એ મહાત્માના  
મહાન આત્માને !




---

ઉધાડતાં પોતાને મગરવાડાનાં સ્થાનકે જેથા. આ સ્થળે એમણે વીર  
શ્રીની આગા અનુસાર એમની પિંડીની સ્થાપના કરી.

જે કોઈ સત્યતાથી આસ્થા રાખીને વીર માણિલદનું આરા-  
ધન કરે છે તેની સર્વ આશાઓ સંપૂર્ણ થાય છે. ૦૮, અભિ,  
એરી સાપ, ભરાય ગ્રહ, દુષ્ટ રાન્ન, રોગ, લડાધ, રાક્ષસ, શત્રુઓનો  
સમૂહ, ભરકીનો ઉપદ્રવ, ચોર, શિકારી પશુઓ અને મહોન્મત  
હૃદ્યાઓનો લય, તેમજ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુર્બિલ્કષ સ્વચ્છ  
(પોતાની સેનાનો લય) ૫૨ ચક (પાણકા રાન્યનો લય) એ તમામ  
અધોમાથી રક્ષણું કરે છે.

## પ્રકારણ ૧૧ મુ

— — —  
વીર માણિભદ્ર

ચૂતુમોસ જિતથી પછી આચાર્ય શ્રી હેમવિમળસ્ફુરિને  
ગુજરાત તરફ વિહાર કર્યો. અનેક શહેરો, નગરો અને  
જામામાં વિચરતા અને ભાવિક લુયોને પ્રથ્યાધતા તે આગળ  
ને આગળ ચાલવા લાગ્યા. કેટલાક રિવસેના અવિરત પ્રથાસ  
આદ જે ડેકાણે માણેનું ક્ષેડનો દેહાંત થયો હતો, તે  
પાલણુપુર નજીવીકના પ્રહેશમાં આવી પહોંચ્યા. આ કથળે

એમને એકાએક એવી આત્મસ્પુરણા થઈ કે શાસન હેવીનાં સૂચન અનુસાર આ સ્થાનમાં અવશ્ય કંઈક દિવય દર્શનની પ્રાપ્તિ થવી જોઈએ. આ આત્મપ્રેરણા સુજણ એમણે આગળ વધવાનું છોડી દીધું અને એજ સ્થળે અહુમનો તપ કરીને કાઉસગા ધ્યાનમાં એસી રહ્યા.

આચાર્યશ્રીના આ તપના ગ્રલાવે વ્યાંતર ઈદ્ર માણિલદ્ર-વીરનું આસન ચળાયમાન થયું. અવધિજ્ઞાનથી એમને લાણુવામાં આવ્યું, કે એમને લવસસુદ્રથી તારનાર મહાન ઉપકારી આચાર્ય શ્રી હેમવિમળસૂરિ અહો કાઉસગા ધ્યાનમાં બિરાજેલા છે.

આચાર્યશ્રીને વંદના કરવા અર્થે વીર માણિલદ્રે આવન વીર અને ચોસઠ જોગણીની પોતાની હેવસેના સહિત આવીને ઘેરા ગંભીર ધ્વનિથી અંતરીક્ષમાંથી પોતાનાં આગમનનું સૂચન કર્યું.

“ જાનેપકારી, પરમપૂજય સદ્ગુરુશ્રીને હું સપ્રેમ વંદના કરું છું ”

“ ધર્મલાલો ભવ: ” આચાર્યના સુખમાંથી અનાચાસે આ શાખ્યો ખડાર નીકળી ગયા. પરંતુ આસપાસ નજર કરતાં કોઈ પણ વ્યક્તિ દૃષ્ટિગોચર ન થવાથી તે આસ્ક્રિય પામ્યા.

“ આ શું ? અંતરીક્ષમાંથી વંદન કરનાર ધર્મપ્રિય ધીર વીર ! સત્ય સ્વરૂપે પ્રકટ થાઓ ” ગુરુએ ધ્વનિ પ્રતિ ધ્યાન આપીને જણાવ્યું.

“ ગુરુ મહારાજ ! આપે મને ન એળાખો ? ”  
માણિલદ વીરે દેવસ્વરૂપે પ્રગટ થઈ, સન્મુખ આવીને વંદન કર્યું.

“ એળાખુ છું. જગતના વંદનીથ હેવોને કોણુ ન એળાખો ?  
આપ તો દેવકેટિના દેવ જ છો ને ? ” ગુરુદેવે પોતાની કલ્પનાશકિતનો ઉપયોગ કરતાં કહ્યું.

“ આપ મને દેવસ્વરૂપમાં જોઈને એમ જ કહો. એમાં  
નવાઈ નહિ. પરંતુ આપણી એળાખાણુ કંઈ એટલેથી જ  
અઠકતી નથી. ” વીર શ્રી એ જણાવ્યું.

“ તો તેથી વિશેષ શીરીતે જાણી શકું ? હું તો એક  
મનુષ્યકેટિનો લુચ છું. ” આચાર્યશ્રીએ પોતાની યથા-  
સ્થિત સ્થિતિ વ્યક્ત કરતાં કહ્યું.

“ આપ મનુષ્યકેટિના હોવા છતાં અનેક લુચોને  
દેવ કેટિમાં મૂકી શકવાનું સામર્થ્ય ધરાવનાર એક મહાન  
આત્મા છો. ” દેવે આચાર્યશ્રીના અજાણ સામર્થ્યની સુતિ  
કરતાં કહ્યું.

“ હું તો અધિકારી લુચોને ધર્માધ આપીને સત્ય-

માર્ગ બતાવનાર નિમિત્ત માત્ર છું.” ગુરુએ પોતાની માનવ-  
સહજ અશક્તિ વ્યક્ત કરતાં કહ્યું.

“ ખરેખર, આપ તો ધર્મના મહાન સંરક્ષક છો.  
ભૂલેલા જ્યોને સત્ય માર્ગ બતાવીને તેમના ધર્મની રક્ષા  
કરો છો.” વીર ગુરમહારાજની પુનઃ પ્રશંસા કરતાં કહ્યું.

“ સાધુવેશ એ લોકકલ્યાણ સાધવામાં અને ધર્મની  
રક્ષામાં જ સાર્થક થાય છે.” આચાર્યશ્રીએ સાધુત્વની  
સાર્થકતા શામાં છે તે જણાવતાં ઉચ્ચાયું.

“ ધન્ય છે ! આપની નાતા, નિઃસ્પૂહતા, અને  
સત્યતાને ! ” હેવે ગુરુહેવ પર ધન્યવાદ વરસાંયા.

“ હેવે આપ કૃપા કરીને કહેશો કે હેવકોટિમાં  
આપનું સ્થાન કયા હેવ સ્વરૂપે છે ? ” ગુરુએ પ્રશ્ન કર્યો.

“ અત્યારે મને જે સ્થાન પ્રાપ્ત થયું છે તે આપ મહે-  
દ્યનું જ અપાવેલું છે.”

“ મારું અપાવેલું ? આપ શું કહો છો ? ” ગુરુ  
એકદમ આશ્રયચક્તિ થઈ ગયા.

“ હું ઉજઝયિની નગરીના નગરશોઠ માણુકશાડ  
શ્રેષ્ઠીનો જીવ આજે વ્યાંતર ઈંદ્રવીર\* માણિબદ્રના નામે  
ઓળખાઉં છું ”

---

\* ઈંદ્ર ચોસઠ ગણ્યું છે. હશ હેવલોકના ઈંદ્ર, વિશ ભુવન-  
પતિના ધંડ, સોળ વ્યાંતરના ધંડ, સોળ વહાણુંવ્યાંતરના ધંડ, ઉપ-

“ માણેકશાહનો જીવ ! ” શુરૂનાં આશ્ર્યેનો પાર રહ્યો નહિં.

“ હા, શુરૂહેવ એજ ! આથામાં ચાતુર્માસ કરવા આપના શરણુમા રહેલો, અને ત્યાં શ્રી સિદ્ધાચણ માહાત્મ્યનું શ્રવણ કરાવીને આપે જેનો ઉદ્ધાર કર્યો તે જ આ માણેકશાહ ” માણિલદરવીરે પોતાની પૂર્વકાળની પિછાન આપતાં જણ્ણાંયું.

“ ત્યારે શું માણેકશાહનો.... ” શુરૂનું વાક્ય અધૃતું રહ્યું.  
“ હા, દેહાંત થયો. ” અધૃતું વાક્ય વીરશ્રી એ સંપૂર્ણ કરતાં કહ્યું.

“ ઓહ ! કેવી રીતે દેહાંત થયો તે કહે શો ? ”  
શુરૂએ જાંડી ઉદ્ઘાનતાથી પ્રશ્ન કર્યો.

રાંત સર્વી અને ચંદ્ર મળી ચોસઠ જાતિના ઈંડ કહેવાય છે. બ્યાંતર-જાતિના દેવોમાં મુખ્ય આઈ જાતિ છે. કિન્દર, કિન્મ પુરસ્ય, મહોરગ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ તેઓએ સ્વર્ગ, મૃત્યુ અને પાતાળમાં સર્વ રથે સ્પર્શ કરતા, સ્વતંત્રપણે એક ધીજનાં સહવાસમાં ભરજી મુજબ ગતિ કરતા ચારે દિશાઓમાં ધૂમતા રહે છે. વળી કોઈ તો માણસોની સેવકોની પેટે સેવા કરે છે, અને અનેક પર્વત, શુદ્ધા, ગાઢ વન, ઓલ (કંદરા) ધર્ત્યાહિમાં નિવાસ કરે છે. તેથી તેઓ બ્યાંતર કહેવાય છે. તેઓમાં કોઈ અમૃતક ક્ષેત્રનું રક્ષણ કરનાર હોવાથી ક્ષેત્રપાળ કહેવાય છે.

“ પગપાળા પ્રવાસ કરીને શ્રી ચિદ્રાચળનાં દર્શન વંદન કરવાનો આપની પાસે અભિગ્રહ ધારણું કરીને આ સ્થળે આવતાં ડોઈ જગલી મનુષ્યોએ દ્રવ્યની લાલચે શ્રી સિદ્ધાંગિરિ રમરણુમાં મસ્ત એવા માણેકશાહ શેડનાં શરીરને ધાત કર્યો, ” હેવે માણેકશાહ શેડના દેહાંતનું કારણ રજુ કરતાં કહ્યું:

“ શ્રી જિનશાસન દેવની શું એવી જ ધર્છા હશે ? ” શુદેરૂપ ઉદાસીનતાથી ગાદગદ કંઠ થઈ ગયા.

“ હા દેવની એ ધર્છાના પ્રતિક્રણ ઇપેજ મને આજે દેવસ્વરૂપે જોઈ શકો છો. હેવે આજા કરો કે હું આપ ગુરુ-દેવની શરીર સેવા કરી શકું ? ” હેવે ઉભય હસ્ત જોડી ઉચ્ચાર કર્યો.

આ વખતે આચાર્યશ્રીએ પોતા પર વીતેલી તમામ હુકીકિત રજુ કરતાં જણાવ્યું, કે “ આથામાં ડોઈ અકળ અને અતિગૃહ કારણું લઈને મારા દશ શિષ્યો ન સમજાય એવી દીવાનાની દશામાં ધણું જ રીખાઈ રીખાઈને મરણું ને શરણ થયા છે, અને અગિયારમે શિષ્ય પણ એ જ હાલતનો લોગ અની કટોકટીલરી સ્થિતિમાં પડેલો છે. આ અતિ ગંભીર ઘટનાના જેહના ઉકેલ મારે જ શ્રી શાસન દેવીની આજા અનુસાર અમે અત્રે આવેલા છીએ. અને અમેને

હવે તો પરિપૂર્ણ પ્રતીતિ થઈ છે, કે એ હુઃખ દ્વારાનું નિવારણ આપ જ કરી શકશો। ”

આચાર્યશ્રીની આ વાણી સંભળીને વીર માણિલદ્ર પણ સ્તળધ થઈ ગયા. થોડી વાર તેઓ મૌન રહ્યા. અવધિજ્ઞાન વડે જેતાં એમને તરત જ પ્રત્યક્ષ થયું, કે આ ઉપદ્રવ લોંકાગચ્છના આચાર્યે સાધેલા કાળાગોરા લૈરવનો જ છે. વીરશ્રીએ ગુરુહેવને આશ્વાસન આપ્યું અને પોતાની સેનાના ખાવન વીરામાંના એક વીરને કાળા ગોરા લૈરવને હાજર કરવા આજા કરી.

વીર તરત જ વિહાય થયો. અને અહ્ય સમયની અંદર કાળાગોરા લૈરવને શ્રી માણિલદ્રવીર પાસે લાવીને હાજર કર્યા. લૈરવ હાથ જોઈને આજાની રાહ જેતા માણિલદ્ર હેવ સમક્ષ ભાલા રહ્યા.

“ લૈરવહેવ ! પોતાનાં ધર્મધ્યાનમાં જ પ્રવૃત્ત એવા સંત પુરુષોને ઉપદ્રવ કરીને તમે મહા અનિષ્ટ કર્યું છે. આવાં અધમ કર્મનાં ઉપાજ્ઞનથી તમારું કોઈ કાળે કલ્યાણ થવાનું નથી. માટે તમે તરત જ જૈન સાધુઓને સતાવવાનો તમારો ઉપદ્રવ હુર કરો, ” માણિલદ્ર વીરે કાળાગોરા લૈરવને એમનો ઉપદ્રવ હુર કરવા આજા કરી.

“ પ્રભુ ! આપની આજા અમોને સર્વોદા શિરસાવંદ્ય જ

હોય. પરંતુ આમાં તો અમે મંત્ર બળ વડે બંધાયેલા છીએ. એટલે અમારી ઈચ્છા હોવા છતાં પણ અમે એ બંધનમાંથી છુદી શકવાને અસમર્થ છીએ.” કાળા ગોરા લૈરવે હેવની આજાનો અમલ કરવાની પોતાની અશક્તિતું કારણ રજુ કરતાં કહ્યું.

“તમે સીધી રીતે નહિ ભાનો તો સખત હોય કામ કેવું પડશો” હેવે જરા ઉથ અવાજે ઉચ્ચાર કર્યો.

“મહારાજ ! આપ અમારા સ્વામી છો; પરંતુ અમે પરાધીન છીએ. આપ જે બળ જરૂરીથી આપની આજાતું પાલન કરવા ઈચ્છા હોય, તો આપની સામે પણ અમેને ચુદ્ધમાં ઉત્તરવાની ઝરણ પડશો.” કાળાગોરા લૈરવે પોતાના નિશ્ચયની અડગતા દઢતાપૂર્વક જણાવી દીધી.

માણિલદ હેવે હેવે વિચાર્યું કે આ લોકો શાન્તિપૂર્વકની સમજાવટને કદી પણ વશ થાય એમ નથી. એમના અતિ ઉથ અને તામર્સી સ્વભાવને પહોંચી વળવા માટે હેવ માણિલદે પોતાનાં હેવત્વને આધારે વૈક્રિયલભિધ હોરવી, સોણ ભૂલાયોને ધારણ કરી કાળા-ગોરા સાથે ચુદ્ધ કરી તેમને નમાવ્યા, અને આચાર્ય શ્રી હેમવિમળસૂરિના પરિવાર પરનો એમનો ઉપદ્રવ સહાને માટે ફૂર કર્યો અને અગિયારમા સાધુ મૃત્યુમુખમાંથી ઉગરી ગયા.

આ રીતે ઉજાજયિની નગરીના એક વખતના નગરશોઠ માણુકશાહ શ્રેષ્ઠીએ પોતાના અપૂર્વ ધર્મપ્રેમ અને અદ્ભુત આત્મઅલિદાનને લીધે હેવ કેટિનું અતિ હુલંબ સ્થાન પ્રાપ્ત કરીને પોતાનું યશસ્વી નામ સહાને માટે અમર કર્યું.

હનારો ધન્યવાદ હો ! એ ધર્મત્માના પુરમ પવિત્ર આત્માને !

## પ્રકરણ ખારભુ

-૧૦૧-

### પૂજન વિધિ

૩૧૨ માણિબદ્ર એ સોળ પ્રકારના વ્યાંતર ઈદ્રમાંના એક છે. એમનું પૂજન-આરાધન શી રીતે કરવું, તેનાં અનેક વિધાનો શાખમાં ખતાવેલાં છે. પરંતુ તેમાં સહેલી, સાદી અને સૌથી અની શકે એવી વિધિ આ નીચે આપવામાં આવે છે.

આઠમ, ચૌદશ, તથા માસના દરેક રવિવારે આંદેલ કરવું. અને જે ડેકાણે વીરતું સ્થાનક હોય તે ડેકાણે, આંદેલ હોય તે હિન્સે ધૂપગીપ વગેરે અષ્ટદ્વયથી પૂજા કરવી.

અને જ્યાં સ્થાનક ન હોય, ત્યાં ઇકત આંધેલ કરીને નિમ્ન-  
લિખિત મંત્રની એકલીસ નૌકારવાળી ગણુવી તેમજ સ્થાન-  
કવાળાએ પણ ગણુવી.

### મંત્ર

ॐ અસિઆઉ સાય નમઃ પઠોશ્રી માણિભદ્ર દિશતુ મમ  
સદા સર્વકાર્યેષુ સિદ્ધિમ् ॥

આસો સુદ ૧૦, માહ સુદ ૫, તથા વૈશાખ સુદ ૩ આ  
દિવસોમાં ધણુ ચાત્રાગુણો બાધા મૂકુવા આવે છે. કોઈ-  
કોઈવાર રવિવાર, મંગળવાર, આઠમ, ચૌદશ એ દિવસોમાં  
પણ બાધા મૂકે છે. વળી કેટલાક લોકો જાતે બાધા મૂકુવા  
આવવાને અદ્દે ખીંજ કોઈની સાથે વાંટ મોકલી આપે છે. પરંતુ  
એ પ્રમાણે કરવાથી બાધા વળતી નથી તથા કુળની વૃદ્ધિ થતી  
નથી. માટે જેને બાધા કરવાની હોય તે માણુસે પોતે પોતાના  
ખાળક સહિત સ્થાનકે આવીને બાધા કરવાની આવશ્યકતા છે.

ઉપરાંત માણિબદ્રવીરનું વચન છે કે, હવે પણી તપ  
ગરુણની પાટે જે આચાર્ય થશે, તેમનું હું સ્વયં ધર્મરક્ષણ  
કરીશ. માટે આચાર્યોએ પરહેશમાં વિહાર કરતાં પહેલાં  
શ્રી માણિબદ્રવીરનાં સ્થાનકે જઈને ધર્મલાલ આપવાનું  
ચૂકું નહિ. આમ કરવાથી એમની સર્વત્ર જ્યાતિ થઈ  
ધર્મજ્ઞાનની જાડી છાપ લોકોના મન પર પડે છે, અને તેમની  
મંગળકામના સિદ્ધ થાય છે.

## શ્રી મણિભદ્રજીનો છંદ

સત્રસતિ સામિથુ પાય પ્રણુમેવં,  
સુ શુરુ નામ સદા સમરેવં;  
ગુણુ ગાઉ મણિભદ્ર વીરં,  
વીરં માંહી શાહ સધીરં.

૧

ઉજાણેણી નગરી પવિત્રં,  
રાજ કરે વીર વિડમાદિત્યં;  
આવન વીર રમે તિહાં રાસં,  
મણિભદ્ર કેરે તિહાં વાસં.

૨

હૈત્ય નિવારણુ તે તિહાં કીધં,  
ગોરડીઓ નામે પ્રસિદ્ધં;  
માને મોટા મહિપતિ રાજં,  
સંધ ચતુર વિધ સારે કાજં.

૩

કલિયુગમાં જાગંતો પીડં,  
મણિભદ્રતું સ્થાનક દીઠં;  
માલવ હેશ મહીં વર દીધં,  
દુઃખ હુકાલ તિહાં હૂરે કીધં.

૪

ધાણુ ધારં હેશ પ્રસિદ્ધં;  
તિથુ થાનક તિહાં તીરથ કીધં;  
તપગચ્છ નાયક વિધન નિવારં,  
માણિકદ નામે જયકારં.

૫

મગરવાડ તિહાં તીરથ જનં,  
નાચે એકે નાચે પાત્રં;  
મલી સુવાસણુ ગાવે ગીતં,  
ઓચ્છવ મહોચ્છવ થાવે નિત્યં.

૬

લેરી ભૂંગળ સરણુાઈ સાદં,  
વાજે વંસાન ફૈરી નાદં;  
કાલ દદ્દામા ને મૃદુંગં,  
નાચ જંત્ર સારંગી ચંગં.

૭

વાગે રણુસીંગા કરણુટં,  
માણિકદ થાનિક ગહુ ધાટં;  
હામ હામથી આવે સંધં,  
ચંઠન પુષ્પ ચઢાવે ચંગં.

૮

સૂરિ મંત્ર તણુ ધરનારં,  
તે આવે તહારે દરખારં;  
તેને આપે બુદ્ધિપ્રકાશં,  
ગચ્છ નાયક તે લહે સુખ વાસં.

૯

ત્રિભુવન માંહી તેજ અપાર;  
માણિલદ્ર તુ વિશ્વાધાર,  
મહિયલ માંહી મેર સમાન,  
મહા મુનિવર ધરે તુમ ધ્યાન,

૧૦

તેવીસ કોડ હેવોના હેવાં;  
છૈપન કોડ કરે તુજ સેવાં,  
ભણે ભવાની તુજ ગુણુચામાં,  
ચોસઠ જોગણી લહે તમ નામાં.

૧૧

જાણુ ભારત અનોપ ઠામાં,  
આગલોડ વસે તિહાં ગામાં.  
વસે શેઠ વરણુ અઠારાં;  
રાજ સખલસિંહ સુખ કારાં.

૧૨

તસ ધરણી વીરાંખાઈ જેહાં;  
ચોસઠ કલા શુભ લક્ષ્ણ ઢેહાં.  
તસ કૂઝેં અવતરિયો હંસાં;  
રામસિંહ દીપાંથ્યો વંસાં,

૧૩

તિહાં શિખરખાંધ ઊચો પ્રાસાદાં;  
દેવલોક સું માંડે વાદાં.  
સુભતિ નાથ તીર્થાંકર દેવાં;  
ચોસઠ ઈંદ્ર કરે તિસ સેવાં.

૧૪

પુર ખાહિર એક થાનિક સારં;  
શિખરખંધ છે ચિત્રાકારં.

સત્તર તેવીસે મન ઉલ્લાસં;  
શાન્તિ સોમ રહ્યા ચોમાસં.

૧૫

નિશ દિન સુનિવર રહે તુમ ધ્યાનં;  
કરે તપ પણું નહિ અલિમાનં.

અચલ અખીહર હરખે રાજં;  
સારે પરબર કેરા કાજં.

૧૬

માણિકુલદ આરાધન કીધં;  
એકસો એકવીસ દિન પ્રસિદ્ધં.

પ્રત્યક્ષ તેહ થયા તત્પ્રેવં;  
પણું વચન કહે સહિ મેવં.

૧૭

માગ માગ તું હું તૂઠો આજં;  
સારું હું તુજ વાંછિત કાજં.

કહે સુનિવર સુણો ક્ષેત્રપાલં;  
તપ કરતાં સુજ કરે સંભાલં.

૧૮

મહિમા વાધે તુજ ધિણુ ઢામં;  
ખટ દર્શિન જપે તુજ નામં.

મહિમા વાધે હેશ વિહેશં;  
શાન્તિ સોમ હિયે ઉપહેશં.

૧૯

સિદ્ધવઠ સરીએ છે જ્યાં હં;

માણિભરતું થાનિક ત્યાં હં;

જીવ જંત ઉગારણું હારં.

તિણું થાનક તિહાં પાલે અમારં.\*      ૨૦

આવે સંધ મળી બહુ સાથં;

કરે વિનંતી જેડી હાથં,

શુલ પાપડી કરે સુવિચારં

દેવા આવે વરણું અદારં.

૨૧

દીપ ધૂપ પુષ્પાદિક સારં,

વધામણું દેઈ બહુ નારં;

તેલ સીંફર ચઢાવે ચંગં,

કેસર ચંદન રૂડે રંગં.

૨૨

માણિભર તું તૂઠેયો દેવં,

વંધ્યા સુત આપે તતખેવં;

પંશુલ પાઉ તૂર્યા હે હાથં,

ચક્ષુ હીણુને હે ચક્ષુ નાથં

૨૩

તુજ નામે જય વિભ પરમીહં,

તુજ નામે થાય નિરમળ દેહં;

વાય ચોરાશી વીસમા રોગં,

માણિભર નામે ન ડોય સોગં.

૨૪

\* અહિંસા.

કુષ્ટ અદાર તુંહી નિવારં,  
તુજ નામે જાય નિરધારં;  
હૈયા હોળી ને કંડમાલાં,  
તુજ નામે થાય વિસરાલાં

૨૫

વાયુ વાળા ને વળી શૂલાં,  
વિસ્કોટક જાચે તે ભૂલાં;  
વ્યાધિ શરૂ ને સનિપાતાં,  
તુજ નામે ન કરે ઉયઘાતાં.

૨૬

કામણુ દુંમણુ મંત્ર જંત્ર,  
ઓષ્ઠ જડી ને વળી તંત્ર;  
સાકિની ડાકિની ભૂત પ્રેતાં  
તુજ નામે જાચે રણુ એતાં.

૨૭

અહ પીડા ન કરે હેહાં,  
ફૂરથી હોષ ટળે તત્પેવાં;  
પૂરવ પુન થાચે સનમુખ,  
માણિલદ નામે સવી સુખાં

૨૮

મણિધર ઇણિધર ને વિકરાલાં,  
તુજ નામે થાય કૂલની માલાં;  
વાધ સિંહ આવે દઈ ક્ષાલાં,  
તુજ નામે નાસે તત્કાલાં

૨૯

ભર દરિયામાંહી તોઢાનં,  
એકી તોડે માણિલદ્ર પ્રધાનં;  
પર દલ આવ્યાં ફૂર પલાયં  
વૈરી કોઈ ન માંડે પાયં.

૩૦

મારગ ભૂલ્યા મેલેઃ સાથં,  
જળમાં દૂખ્યા દીયે હાથં;  
આગ અળંતી શીતળ નીરં,  
દ્યાન ધરે માણિલદ્ર વીરં.

૩૧

અંદીખાનેથી છોડાયં,  
રાજા રૂઠેઓ સનમુખ થાયં;  
ધાડ પડાશી ચોટા ચોારં,  
તુમ નામે કોઈ ના કરે જોરં,

૩૨

ઘર ધરણી સું નિરમળ ચિત્તં,  
તુમ નામે હોએ પુત્ર વિનીતં;  
દક્ષણાવર્તી ને ચિત્રાવેલં,  
તુમ નામે આવે રંગ રેલં.

૩૩

સોના સિદ્ધિ પુરસો જેહં,  
તુજ નામે રહે ઘર નેહં,  
કામ કુંલ ચિંતામણી રતનં;  
તુમ નામે રહે ઘર જલનં.

૩૪

લક્ષ્મી ધર આવે સ્વયમેવં,  
માણિબદ્ર તુમ તૂઠ્યો હેવં;  
હૃદ ગય પાયગ સુખપાલં,  
મોટા મંદિર ભરિયા માલં.      ૩૫

નવ નિધિ ધર તણ્ણો સંભેગં,  
માણિબદ્ર નામે સુખ લોગં;  
અં કાર જપીએ તુમ નામં,  
સીજે સુજ મન વાંચિત કામં.      ૩૬

પવિત્રપણે ધરે તુમ ધ્યાનં,  
તે નર પામે જગમાં માનં,  
સુરવર માંહી વડો જેમ ઈદં;  
અહુગણુ માંહી વડો જેમ ચંદ્રં.      ૩૭

ખલવંત માંહી ખાહુ ખલ વીરં,  
વીરા માંહી માણિબદ્ર વીરં;  
રચના કરે કવીશ્વર કોડં,  
કરી ન શકે તાહરી હોડં.      ૩૮

શ્રવણે સુણુતાં ખહુ સુખદાયં,  
હુઃખ દાલીર ઝરે પલાયં;  
માણિબદ્ર તું જાગતી જોતં,  
સંધ ચતુરવિધ શાન્તિ પોતં.      ૩૯

## કળાશ

---

છાપય

માણિલદ્ર તું દેવ, સેવ મેં તારી કીધી;

હુઃખ દાલીક જેહ, તેહને શીખ જ દીધી,

દેવમહીં શિરતાજ, કાજ સુજ સધળાં સારો;

મમ શાનુ હોય જેહ, તેહને તુર્ટ નિવારો.

જગતી જેત જગમાં સહી, માણિલદ્ર સાચો સહા,

શાન્તિસોમ કહે સુણો, આપો સુજ સુખ સંપદા.



## ગરણો।

---

( સારુ' સારુ' રે સુરત શહેર ) એ રાગ

લાણી વીણાપાણિ વરદા, મન સમરી જગમાતરે,  
શુષ્ઠુ શ્રી માણિલદ્રના ગાઉં, વિશ્વ વિદિત વિખ્યાત,  
સુખકર સાચો છે.

વીરાના સુગટમણિ વડવીર, સુખકર સાચો છે.  
ધ્યાઉ' ધર્મધુરધર ધીર, સુખકર સાચો છે,

એ ટેક.

ખાવન વીર માણી મહા અળિયા, મહિમા વંત મહંત હૈ,  
સુર નર નરપતિ જેને સેવે, અકલ પ્રતાપ અનંત,  
સુખકર સાચો છે. ૨

માલવ દેશમાં મહિમા મોટો, ઉજ્જેણીમાં અખંડ રે,  
ગોરડિયો. જિછાં નામે ગવાયો, હુષ્ટને દેતો હંડ  
સુખકર સાચો છે. ૩

ધર્મ ધરા દેશો ધાણુ ધારે, મગરવાડા માણી રે,  
પાતનપુર વર પુરની પાસે, તેજ તપે જે ત્યાંછીં,  
સુખકર સાચો છે. ૪

તપગચ્છ વિદ્ધ નિવારણ કારણુ, જગતી જીવોત જાણુથરે,

ચંદ્ર પ્રતાપે ચિહુ દિશે ચાવો, શુણુ જગ જેના ગાય.  
સુખકર સાચો છે. ૫

શુજ્રે ધર્મમાં શ્રેષ્ઠ ગણ્ણાયો, સાખરમતી તટ સારદે,  
અગસ્થ મુનિના આશ્રમે, અકીટ અગસ્થ પુર અવતાર.  
સુખકર સાચો છે. ૬

તરલીટ નિરંતા ગીતતી રે, વિલસિત વૃક્ષ વિશેષ રે,  
વિકસિત ઉપવન વેલી વિલાસે, જહુ શોભિતપુર ઐશ.  
સુખકર સાચો છે. ૭

ધ્રાઘણુ ક્ષત્રિય વૈશ્ય વિશેષે, વળી શ્રદ્ધાદિક વાસ રે,  
આવક પણુ જિહાંવસિયા સુખિયા, નિજનિજ ધર્મ નિવાસ  
સુખકર સાચો છે. ૮

સુમતિ જિનેશ્વર હેવ સુહંકર, પ્રભુકર્વયાણિક પાસ રે,  
સુંદર એ જિન મંદિર શોલે, અચરતાં આવે ઉદ્વાસ.  
સુખકર સાચો છે. ૯

સંવત સત્તર તેચીસ સાદે, રામ સિગવડ રાજ, રે  
રાજગાઢી પર ખંડો રાની, નીડર નકતા નવાજ.  
સુખકર સાચો છે. ૧૦

શાન્તિ સોમે તેજ સમામાં, સાધ્યા વીર સુલાણુ રે,  
સાધંતા એકસો એકવીસ દિવસે, પ્રગટ થયા તે પ્રમાણ.  
સુખકર સાચો છે. ૧૧

પુરણુ વીરનો પરચો, ગ્રસચો, દેશ અને પરહેશ રે.  
ખટ દર્શન જન પૂજે ખાંતે, હરખ ધરી રે હંમેશા,  
સુખકર સાચો છે.

૧૨  
સંધ આવે કરી લાવે સુખડિયો, લાવ ધરી લલી લાંતારૈ;  
ચરચે સિંહર તેલ ચડાવી, ખરચે ધન ખરી ખાંત,  
સુખકર સાચો છે.

૧૩  
આશા પૂરે સૌ જનોની, શુરાનો શિરતાજ રે;  
બક્ત જનોની ભીડો લાંગો, આપે સમયો અવાજ;  
સુખકરસાચો છે.

૧૪  
ડાકુણી—શાકુણી ભાગો ડરતી, ચૂઢેલ ડરતી ચાળ રે,  
અંપડી આવી સામું ન જાંણે, અંપે દાવાનણ ભણા;  
સુખકર સાચો છે.

૧૫  
ચોર ચુગલનું જોર ન ચાલે, હુશ્મન નાસે હૂર રે,  
ન્યાંતર કારણુ કંઈ નવ લાગે, લાગો ભૂતડાં ભૂર;  
સુખકર સાચો છે.

૧૬  
આજ લગણુ પણુ ૧આગલોડે આ, પરચો હે પ્રત્યક્ષ રે  
સેવંતાં હૂર કરે સૌ સંકટ, લાવી દયામાં લક્ષ;  
સુખકર સાચો છે.

૧૭  
એજ વીર તણુ આધારે, એકવીસ હિન અનુધાનરે,  
પ્રીતે સાધી પૂરણ કીધું; વસુધારાનું વિધાન.  
સુખકર સાચો છે.

૧ ગામનું નામ છે.

વર્ષો એળાણીનેં પંથાવન, મનોહર ચૈતર માસ રે.  
સૃષ્ટિ મંગળવારે સાધન, પૂરણ કીધું પ્રકાશ.

સુખકર સાચો છે. ૧૬

વીજપુર શુભ શહેર વાસી, અમૃત વિજય તે આવી રે.  
વીરનું ધ્યાન ધરીને વસીયા, લક્ષ સાધનમાં લાવી.

સુખકર સાચો છે. ૨૦

લાલ ઝચીળના બહુ લાયક, હોલત ઝચીળ દક્ષ રે,  
પરમ ભિત્ર મુજ તાસ પસાચે, સુખથી વસિયો સમક્ષ.

સુખકર સાચો છે. ૨૧

ઉત્તમ શુરેના દિક્ષિત ઉત્તમ, રત્ન વિજય શુરુ રાય રે,  
તે શુરેના પદપદ્મ પ્રતાપે, થિર જશ જગમાં થાય.

સુખકર સાચો છે. ૨૨

શીખે શીખે ને સંભળાવે, રૂડે કંડે રસાળ રે,  
શુષ્ણ અમૃત વીર વરની ગાવે, પામે મંગળ માળ,

સુખકર સાચો છે. ૨૩



આ ગરખો વીજપુરના રહીશ યતિ શ્રી મહારાજ અમૃતવિજયજીને  
રચેલો છે,

## શ્રી માણિલંડ યક્ષકી સુતિ

( ૪૬ )

જય જય અંકારા, જય જય અંકારા.

આરતિ ઉતારે, શાસન રખવાળા.

સમકિત દષ્ટિ સુરવર સોહે, મંગળ નિત કારા.

માણિલંડ નામે સુરજક્ષ, તપગચ્છ સુખકારા. ....જય

મંજર અંકુશ નાગ વજર લુજ, ગુરજ સુખધારા.

રૂપ અવતાર વરાહ સરીખા, ગજપર અસ્વારા. ....જય

કુશળ કરે જે નામ લીધે નિત, આનંદ કરનારા.

જગજસ વાધે આસકો સાધે, લક્ષ્મી ધસકારા. ....જય

વીરવાર ગુલ પાપડી લાડુ, લઘન સીરી એચારા,

ધૂપ દીપ નૈવેદ સહંકર, આઠમ દીન સારા. ....જય

વેયાવચ કર્તી સથ સુરવર, કાઉસગ્ગ ચિત્ત ધારા,

આતમ વદ્વલભ સહજ ધરી જે, આવ્યાશ્યક છારા. ....જય



## માણીભદ્ર છંદ

---

સુરપતિ નિત સેવિત શુલવાણી,  
વિષુધ વૃંદ વૃંદિત અક્ષાણી;  
અધિકાનંદ ઉદ્યસ્યું જાણી,  
પ્રણામી સહુ શારદ સુપરાણી.      || ૧ ||

વિમલ વચન મૂળ ઘો વર દાતા,  
ગુણનિધિ ગોરડીયા ગુણ ગાતા;  
ભૂજલ જિન મોહન મુનિ ભાતા,  
ત્રિલુલનમાં એલત વિખ્યાતા.      || ૨ ||

માણિભદ્ર મહિ મંડલ મંડન,  
અંધારી એલે અલ અંડન;  
ગોરડીઓ ફરિજન જન ગંજન,  
લગત વચ્છલ લય લાવઠ લંજન.      || ૩ ||

દુષ્પા

વીર સુણો એક વિનતી, સેવકની સુવિચાર;  
પરિ પરિ પીસુ ન પરાલવે, કરૈ તેહનો નિર્સ્તાર.      || ૪ ||

અલિમાની અક આગરા, અપજસ કરી અપત્ય;  
 કપટી કુડક બુદ્ધિયા, નિર્દ્ય નિખર નિસત્ય. ॥ ૫ ॥  
 માણિલદ્ર માતાપિતા, અડવડિયા આધાર,  
 શૈવપાલ ધરી આતશયું, શત્રુ કરે સંહાર. ॥ ૬ ॥  
 ખાવન વીર માંડે સભલ, જગી લગતો જસવાય;  
 પ્રભુ મનવંછિત પૂરવો, ગુણીયણુ જસ ગુણુંગાય. ॥ ૭ ॥

### ત્રિલંગી છંદ.

ગુણુ ગાઉ લગતે એકચિતે ખરીય ખંતે તાહરા,  
 વિરાધિવીરા ધરણી ધીરા તુંહિ લેરવ ડિનરા;  
 તુંહિ બરડો તુંહિ બાળર તુંહિ ચોવડિ ચાચરા,  
 શ્રી માણિલદ્ર સુલદ્ર જય જ્યકર શત્રુઃસીંહર માહરા. ॥ ૮ ॥

મહાકાલ તુંહિ વીરહર સિદ્ધ હરાડો તુંહિ જોડીઓ,  
 રાતીઓ જાંગડ તુંહિ ચાસુંડ માંકડો જંગોડીઓ;  
 આગીઓ ઢામિ ઢામિ પીઠ પર સિદ્ધ તુઝ ખરા,  
 શ્રી માણિલદ્ર. ॥ ૯ ॥

શાકિની ડાકીની ભૂત બ્યાંતર રાક્ષસી સીકોતરી,  
 તુઝ નામે નાસે દીખ નાસે દુષ્ટ નહુતિ નિરખે ઇરી;  
ચોવટેં ચાચર તુંહિ એલે સકતિ એલેં સંકરા,  
 શ્રી માણિલદ્ર. ॥ ૧૦ ॥

તું વિષમ વાટે ગિરિય ધાટે જલધિજલ પૂરે વહે,  
નડયનડ સંકટ વિકટ કણે આદમી જે સુખ લહે;  
તુઝ નામ જપતાં કુસલ ખેમે પ્રેમસથું આવે ધરા,

શ્રી માણીલદ્ર. ॥ ૧૧ ॥

અડભૂજ ભયહર અડગ વિષધર પાસ પાણી પીડાકાએ,  
અર્જુગશુલ કપાલ માલા ડમક ડમર ડાકાએ,  
કલ દેવિ કરતો ધરણી રમતો વૈરી દમતો આતુરા,

શ્રી માણીલદ્ર. ॥ ૧૨ ॥

પાય ધમે ધુધર જેગ જટધર હાથ અપર અરતરં,  
અદ્ધાંડપિંડ પ્રચંડ નવખંડ અગનિ જોવે અડગ ધરં;  
કૈલાસ સિખરે સમુદ્ર તિરે દિસે દિસંતુ ઐચરા;

શ્રી માણીલદ્ર. ॥ ૧૩ ॥

ળ્લભૂત નીલ સમાનરૂપં સરૂપ તાહર કુણુ લહે,  
સુર અસુર માન હેવ દાણવ આણુ તાહરી સિર વહે.

તું મંત્રમૂલી ચંતતંત્ર ચંદ્રમાર વિ શુલકરા,

શ્રી માણીલદ્ર. ॥ ૧૪ ॥

દીવાણુ તૂંહિ અરજવેળી તૂંહિ કાળુ અહલ તું,  
તૂંહિ ચક્કિતા તૂંહિ મેહતા તૂંહિ મીરા પઠલ તું;  
તે લાણી તુઝને કહું ઐતલ ચિત્તધરી તું સુરબરા,

શ્રી માણીલદ્ર. ॥ ૧૫ ॥

નવનીદ્ર રીદ્ર સમૃદ્ધિ દાતા જગતિ નેતા તું સહા,  
વાંછિત પૂરણુ કષ્ટ ચૂરણુ સુક્રવિ યાદે આપદા;  
તુંહિપિતા માતા તુંહિ પ્રાતા નાથસ્વામિ સહેદરા,

શ્રી માણ્યિબદ્ર. ॥ ૧૬ ॥

નિહું ભુવન હીડે યક્ષ કેઢે ઇરે સેવા જારતા;  
પારડી સાધુ અસાધુની તું લહે જગની વારતા,  
જગતી મુરતી ભવન તાહરી પાય પૂજે સૂરનરા;

શ્રી માણ્યિબદ્ર. ॥ ૧૭ ॥

જે મરમ એલા લુ ભર્દુ લોલા વિઠલ લચતા માનવી,  
પરવિધન દોખા તરત દોખા વહે વાણી નવનવી,  
કલિ કરણુ રાતા પટરાતા કુમતિહાતા અનુચરા,

શ્રી માણ્યિબદ્ર. ॥ ૧૮ ॥

વિષુ ગુનહવેરી જન ભંસેરી આદયોદે અણુછતા,  
કરણહી અસમર છેડે અરચિસ્વારે વરી વ્યાપતા;  
ઉપગાર કીધે મનન જાણુ ગરણી ગુનહ ગોખરા,

શ્રી માણ્યિબદ્ર. ॥ ૧૯ ॥

પરગુણુ ન એલે શિષ્ટદોદે દુંડી પરે ભમતા ભમે,  
પર રીખ હેખી હુઃખ અલેખી સાધુ સજનને દમેં;  
ખરખરે એકડ સાહ બરકેં હરામિ હર કતિ કરા,

શ્રી માણ્યિબદ્ર. ॥ ૨૦ ॥

## કલસ

શૈત્રપાલ ભૂપાલ આપને માઝા સુઝને સમરથ સાહેબ જાણ,  
યાચના કીધી તુઝને કરતાં અહી ત્રીસુલ કંથ કાપે કટકના;  
ઝડિ સિદ્ધ ધરાણુ.

કોડી પુરે તુઝ મનના મગરવાડા પુરમંડળો અતુલીખલ અશરણ  
શરણ રાજ રતન પાઠક વિનવે શ્રી માણીલદ્ર જ્ય જ્ય કરણુ.

---

## શ્રી માણિલદ્રલનો છંદ

( તોઠક )

શ્રી માણિલદ્ર સહા સમરો,  
ઉર ધીયમેં ધ્યાન અખંડ ધરો;  
જપીયાં જ્ય જ્યકાર કરો,  
લળ્યાં સહુ નિત્ય લંડાર લરો. ૧  
ને કુશળ કરે નામજ લીયા,  
આનંદ કરે દેવ આશ કીયા,  
સૌલાય વધે જગ સહસ્ર ગુણો,  
દિલ સેન્ય હે પ્રભુ જશ ફુણ્ણો; ૨

અરિયથુકુ+ સહુ અલગા ભાગે,  
વિડુઅનાં વૈરી જન પાય લાગે;  
સંકટ ચોક વિદોગ હરે,  
ઉંઘુ વેલા<sup>1</sup> આપ સહાય કરે. ૩

ભૂત ભયંકર સહુ ભાગે,  
જલ ચોગણી સાયણી નવી લાગે;  
વાય ચોરાશી જાય અલગી,  
લખમી સહુ આય મળે વેળી. ૪

ગુલ-પાપડીયાં ગુરુવાર દિને,  
લાપસીયા લાડુ શુદ્ધ મને;  
ધુપ દીપ નૈવેદ્ય ધરો,  
આડમ દીન પુલ અવશ્ય કરો. ૫

નેહને દિન પ્રતિ જપ સહા,  
તસ સુપનાં તરમે પ્રત્યક્ષ કદા;  
જપીયાં સહુ જાણે જપહા,  
કોઈ મેળું રહે ન કદા. ૬

+ અરિયથુ = શત્રુ + વિડુઅન = નિરોધ. ૧ ઉંઘુ વેલા = ખરે  
વખતે. ૨ સાયણી = શાકિની, ડાકુણુ. ૩ પ્રતિદિન સમરણ કરવાથી  
રમનમાં આવી દર્શન હે છે. ૪ મણા = ખામી,

મુહૂર્મદ સારુ તમેં જસ કરેયો,  
ગુણુ સાયર લુસ્થો તમે ગુણુ ભર્યો;  
શ્રી દીનાનાથજી દ્વારા કરે,  
શિર ઉપર હાથ દીયો સખરો. ૭

અવિયણ ને ભાવે ભજશો,  
કારજ સિદ્ધ આપણી કરશો;  
પુન્નાં પુત્ર વધે ફુશણ,  
કીણ્ણી ચોતે કહી રહે નહિં ઉંણુા. ૮

શ્રી માણુભદ્ર મનમેં ધ્યાવો,  
સુખ સંપત્તિ સહુ વેળો પાવો;  
લક્ષ્મી કીર્તિં વર આપ લહે,  
શિવ કીર્તિં મુનિ એમ સુધરશ ઠહે. ૯



## દોહા.

સરસ્વતી ભગવતી ભારતી, સુમતિ સુગતિ દાતાર; ૧  
 સુજ સુઅ મંહિર તું રમે, સમય સૂધા આધાર.  
 ગંગા ગંગે અતિ શુણી, કમલા કર કમલેણું;  
 જહુ તહુ તુહુ સુઅ સોહિયે, સમય અમિય અમિયેણું. ૨  
 કથિપિ કર કમલે કરે, ચરણે રણુ અણુકાર;  
 માણિલદ્ર શુણ ગાયવા, જનની કરું જુહાર. ૩

## અડિઅષ્ટ્રી છંદ

શારદ શારદ શુભ મતિ દેવી, કવિકુલ કોઠી તું મન ધરેવી;  
 સમય સમય પ્રત્યે સાર કરેવી, ગોરા શુણ ગાડી સમરેવી. ૪  
 માણિલદ્ર વરલદ્ર વિધાતા; વરહાયક વસુધા વિધ્યાતા,  
 વાર વાર વીરા વીનવીયે, સંપત્તિ કારણું તું કવિ સ્તવીયે. ૫  
 તુજ તતુ તેજ દીવાકર દીપે, મહીયદ મહીમા તુજ નવિ ધીપે;  
 પ્રિલુષન રાજ તું જગ રાજે, ગોરા શુણ શુરૂઆ જગ ગાજે. ૬  
 ચાહ કરી ચાહું તુજ સેવા, દ્યાવંત દીપક તું દેવા;  
 સમય સુધારસ જીલણુ હારા, ધીંગડ ધુંબડ તુજ પરિવારા. ૭  
 લથુંકર ભૂતલ ભૂત નસાડે, શાકણુ ડાકણુ ઝુંદે પાડે;  
 રંગે રઘુા રાસ રમાડે, અહુગણુ તારા ઝોઠી લમાડે. ૮

## હાટકી છ'દ

તુ' આપે વ્યાપે, હુર્મતિ કાપે, સંતાપે રીપુ વૃ'દ,  
સહિ સેવા રસીયા, નિકટા વસિયા, હરિહર ચં'હ અમ'દ;  
તુજ તેજે હસિયો, વ્યોમે વસિયો, હિન્કર રહે સં'કંત,  
શુષ્ણુવંત અનંતા, હાસ હસંતા, વલસંતા ઉલ્લસંત. ૬

મયગલ મત્તવાલા, તરલ તુખારા, રહે રાળુ રાજ'ત,  
મલય'તિ ધરણી, પતિમન હરણી, ચં'પક વરણી ક'ત;  
તુમ નામે' પામે', ભૂપ લદેરા શિર નામે', ઉલ્લસંત,  
સુવિનિતા પુતા, વિષુધ વહિતા, વ'છિતા અદવ'ત. ૧૦

## છ'દ ચાલ

ધમધમ ધમકે ધૂધર માલા, ચં'ચળ ચંપળ ચલાવે ચાલા;  
કરિ શરેમે કરવાલ કરાલા, વચ્ચેની હણુવા તુ' વિકરાલા. ૧૧

સઝન જય કર જય સુકમાલા, તતુ તેજે' કરી આકઅમાલા.  
કઠી ક'દોરા સોવનીયાલા, નથન કમલદલ અતિ અણુયાલા. ૧૨

હાર હિયે હીસે હે બાલા, કરણુવંત દચાલ મયાલા;  
સુર તે'ન્ત્રીશા કેટિ સિં'ગાલા, તુ' શિરદાર તિહાં ભૂમાલા. ૧૩

ક'દ ઠવે મણુ મેતી માલા, મદ તાંદોલ ભર્યી ગલ ગાલા;  
મદ ભરી માલે જણુ'મત વાલે, ઠમકાવે પગ પાવડિયાલા. ૧૪

પચ પચે પદમાસન વાલા, ધૂમત ધૂમત ધૂમતિયાલા;  
જન મન મોહન મોહનીયાલા, જાપ જાપે જાલી જાપ માલા. ૧૫

### કામિની મોહન છંદ

અંગહેવાણુ મળિ મિલેહ ઓહાંએ,  
લેહને નામે ધરસરગ વિહોહાંએ;  
બાસ જસજગત જન જાનતી ઓહાંએ,  
મણિલદોઈ સોઈસરો સોહાંએ. ૧૬

### રાહિલા છંદ

રાજે રાજે રે રસાલ, મુહમદ નવિસાલ,  
કરો કરૂણા રસાલ, સતત સાલી;  
કુહ કરો અનિવાર, વર વચન વિચાર,  
સમ સુસ્થ સંભાર, હિયેની અથ હાલી,  
પુત્ર કલત્ર આપાર, જથ સેવક આધાર,  
હિયો હોલત હુઆર, હિયેં હેજ ધરી;  
મહિ મંડલ મંડન, ખલ ખલક ખંડન,  
લૂત લૈરવ લાંડન, સાહી સુસ્થ હંડી. ૧૭

## અહિયલ છંદ

વાદ વિવાદે જે જન ધ્યાવે,  
સો નર અહુ પરે સંપદ પાવેઃ;  
નિર્મલ નામ તમારું જપિયે,  
અશુલ કર્મભતિ તતક્ષણુ અપિયે. ૧૮

## હાટકી છંદ

તું રાચે નાચે, અહુ પરે માચે, જાચે તુજ જાચક;  
વિવિધાયુ દ્વારાંતા, વાસવસારાંતા, જળ કે જિમ પાવક;  
દરખારે વસિયે, તો રૈ હસીયે, ધસીયે અંદન રંગ,  
લઈ કૂલ અમૂલા, ધોળા પીળા, અરચીને તુજ અંગ. ૧૯

## અહિયલ છંદ

સાહિબ તૂંહિ સદા સુખકાર, મથાકર તૂંહિ પિતા પતિ તાર;  
શિવશાંકર તૂંહિ સદા સાધાર, પથ પું એમ હૂં વારંવાર. ૨૦

## છાપય છંદ

મણિલદ્ર સુખકરણુ, સચલ સંસાર વદિતો,  
દ્વાલત દીયે દ્વાલ, દૈત્ય પતિ જૈણે જિત્યો;  
જયકારક જયવંત, જગતપતિ પાતક નાસે,  
તતુ તેજે જલકંત, સતત સંતતિ સુવિલાસે,  
જક્ષરાજ નરરાજ, તનય નિપુણુ નિસુણો સહી,  
ગુણુ ગણુ ગુણુતાં ગોરિયાં લાલ કુશલ લક્ષમી લહી. ૨૧

## શ્રી માણિબદ્ર છંદ

સરસ વચન ધો સરસ્વતિ, પૂજું શુરૂ કે પાય,  
ગુણુ માણિકના ગાવતાં, સેવકને સુખ થાય. ૧

માણિબદ્ર મેં પામિયો, સુરતરૂ જેહયો સ્વામિ;  
રોગ શોગ દૂર હરે, નમું ચરણુ શિરનામી. ૨

તું પારશ તું પોરસો, ડામ કુંલ સુખડાર;  
સાહિય વરદાયી સદ્ગા, અનધાનનો આધાર. ૩

તુંભિજ ચિંતામણિ રતન, ચિંતા સેન નિવાર;  
માણિક સાહિય માડરા, હોલતના હાતાર. ૪

દેવ ધણુ દુનિયાં નમે, સુધ્યતાં કરે સન્માન;  
માણિબદ્ર મોટો મરદ, હીએ દેશ હીવાન. ૫

## અડિયલ છંદ

દીપતો જગ માંહિ દીસે, પિશુન તણુ દલ તું હિજ પીસે;  
અષ્ટ ભયથી તુંહિજ ઉગારે, નિંદા કરતાં શત્રુ નિવારે. ૬

જગ મુખ્ય દેવ મહા ઉપગારિ, ઔરાવણુ જિણુરે અસવારિ;  
માણિબદ્ર મોટો મહારાજ, વાજે નિત છત્રીશોં ખાળ. ૭

હેમવિમલસૂરી વરદાઢ, શૈવપાલ ક્ષણુ ખાડચો આઢચો;  
ઉંણુવેલા માણુક તું ઉંઘ્યો, લૈરવને ગુરળસું કુંઘ્યો. ૮

માનેજ માણિક વચન હમારો, થેં છોડો હું ચાકર થારો;  
માણિલદ્રજ વાચા માની, કાળો ગોરો કિદા કાની. ૯

પાઠ લિંગત પણ વાચા પાલી, વળતી સામગરી સંભાળી;  
નાલિમ માણિક ભાહે આવ્યો, દેશ અઠારે જહિ ઉજવાવ્યો. ૧૦

કુમતિ રોગ કીયો નિકંદન, માણિલદ્ર તપ ગચ્છરો મંડણુ;  
ધ્યન ધરે એક તારી જ્યારે, તેહના કારજ વેલાં સ્થારે. ૧૧

ઓલ શિર રાખે દરખારે, વસુધા કીર્તિ અધિક વધારે;  
આઠમ ચૌદ્ધા જે આરાધે, સધણા જાપ હિવાલી સાધે. ૧૨

શ્રી માણિલદ્ર પૂજે જે મોટો, તિસ ધરે કહિય ન આયે ત્રોટો;  
ભાવે કરી તુજને જે લેટો, માણિક તિણુરા દાલિદ્ર મેટો. ૧૩

ધન અખૂટ તે બહુ ઝંખી પાવે, માણિક તતકણુ રોગ ગમાવે;  
સેવકને તું બાહે સાહે, મહિમા થાયે મહિયલ માંહે. ૧૪

જે સુજને સેવક કરિ જાણો, તો માણિક એક વિનતી માનો;  
ઝીલ ભરી દર્શન સુજને હીને, હૃપા કરી સેવક સુખ કીને. ૧૫

દ્વારા

તું વાસી ગુજરાતનો, નવ ખાડે તુજ નામ;  
મગરવાડે મોટો મરદ, કવિયાં સારે ઢામ. ૧૬

સેવકને થેં શીખવો, હુકમ પ્રમાણુ હમેસ;  
જિથુ વિધ હું પૂજ કરું, સેવા દેવો હમેસ. ૧૭

કરે અનાચી કવિયણુ, માણિલદ્ર માખાપ;  
હિલભરી દર્શન હીળુંયેં, સેવક દાદ સંતાપ; ૧૮

માણિલદ્ર મહારાજસુ' ઉદ્ય કરે છે અરજ;  
મૂલ મંત્ર સુજને દિયો, રાખો માહરી લજ. ૧૯

અડિયલ છાંદ

વસુધામાં મારી લાજ વધારો, ન્યાત ગોત્રમે કુ જશ નિવારો;  
હુઃખ હાલિદ્ર હરિઝે' હુરે, પુત્ર તણી વાંછા તું પુરે. ૨૦

સેનાનીને' તું સમબાવે, અવની પતિ પણુતુમ પાય આવે;  
વિધન અનંતો રાજ નિવારો, માણિલદ્ર સુજ શનુ નિવારો. ૨૧

સધળા તરનારી વશ થાય, શાકિણી ડાકિણી નાસી જય;  
ભૂત પ્રેત તુમ નામેં નાસે, નાંહર ચોર કદી નવ વાસે. ૨૨

મોટા દાનવ તુંહી મરોડે, તાવ તે જરા તુંહીજ તોડે;  
હરિહર દેવ ઘણુાય હોયે, તિથુમે' તુમ સરિસો નહિ ડોય. ૨૩

આવે અડસઠ તીરથ લેટો, આવે શ્રી માણિબદ્રને લેટો;  
 સુરપતિ માહરી અરજ સુખિને, કવિયથુને તતકાણ સુખફીને;  
 ધો વંધીત માણિક વરદાધ, સેવકને ગહુ ગહુ સુહાધ. ૨૪

### કલસ

છોપય છંદ

ગુણુ ગાતાં ગહુ ગહુ, અજ ધન કૃપડો આવે,  
 ગુણુ ગાતાં ગહુ ગહુ, પ્રગટ ધર સંપદ પાવે;  
 ગુણુ ગાતાં ગહુ ગહુ, રાજ માન મોજ દીરાવે;  
 ગુણુ ગાતાં ગહુ ગહુ, લોક સહુ પુન લ્યાવે;  
 સુઅ કુશલ આસ્થા સંક્રલ, ઉદ્ઘય કુશલ એણી પરે કહેણે;  
 ગુણુ માણિકનાં ગાવતાં, લાખ લાખ રીજાં લહે. ૨૫



## આરતી

(જય હેવ ! જય હેવ ! ) એ-રાગ

જય જય નિધિ જય માણિક હેવા !

જય માણિક હેવા !

હરિહર અલ્પ પુરંદર, કરતા તુજ સેવા,

જયહેવ ! જય હેવ !

૧

તું વીરાધિવીર, તું વંછિત દાતા,

તું વંછિત દાતા,

માત પિતા સહોદર સ્વામી,

છે પ્રભુ જગતાતા.-જયહેવ.

૨

હરિ કરિ અંધન કદ્દી, કૃષ્ણિધર અરિ અનલા,

કૃષ્ણિધર અરિ અનલા;

એ તુજ નામે નાસે, સાતે લય સખળા. જયહેવ

૩

દાક વિશુલ કૂલમાલા, પાશાંકુશ છાજે,

પાશાંકુશ છાજે;

એક કર દાનવ મસ્તક, એમ પદ્મ લુજ રાજે. જયહેવ

૪

તું લૈરવ તું કિનર, તું જગ મહા દીવો,

તું જગ મહા દીવો;

કામ કદ્વપતરુ ધેતુ, તું પ્રભુ ચિરંલ્લો. જય હેવ

૫

તમું ગરુદ પતિ સૂરી, ધ્યાવે તુજ ધ્યાનં,  
 ધ્યાવે તુજ ધ્યાનં,  
 માણિભદ્ર ભદ્રંકર, આશા વિઆમં. જય હેવ. ૬  
 સંવત્ અદાર સેં પાંસઠ, શ્રી માધવ માસ,  
 શ્રી માધવ માસ,  
 દીપ વિજય કવિરાયની, પૂરો સહુ આશ.  
 જય હેવ. ૭

